

» વર્ષ : 1, અંક : 10

» 16–30 નવેમ્બર, 2020

વિનામૂળ્યે વિતરણ માટે

# ન્યૂ ઇન્ડિયા

# સમાચાર



લોકોના જીવનમાં  
પરિવર્તન લાવવા માટે  
નવતર શોધો  
આવશ્યક છે.  
પરિવર્તનની આ  
પ્રક્રિયામાં સરકાર હવે  
અટલ ઈનોવેશન  
મિશનના માદ્યમથી  
બાળકોથી માંડીને  
પુખ્તવયના  
લોકોને સમાવી  
રહી છે

નવનિર્માણ સાથે  
નવા ભારતનું નિર્માણ

# વોકલ ફોર લોકલના મંત્ર સાથે ખાદીએ મેળવી વૈશ્વિક ઓળખ



પ્રધાનમંત્રીએ પોતાના પરિવારોથી સેંકડો કિલોમીટર દૂર સરહદો પર રહીને ભારતની રક્ષા કરી રહેલા બહાદુર જવાનો પ્રત્યે એકતાની લાગણી અભિવ્યક્ત કરવા માટે દેશવાસીઓને આ દિવાળીના પાવન પર્વએ દીવો પ્રગટાવવાનો અનુરોધ કર્યો છે અને કોવિડ-19 સામે તકેદારીના પગલાં જરાય કચાશ ના રાખવાનું ફરી ચાદ અપાવ્યું છે.

**વોકલ ફોર લોકલ:** તમે જ્યારે ખરીદી માટે નીકળો ત્યારે 'વોકલ ફોર લોકલ'નો આપણો મંત્ર ભૂલશો નહીં. આપણે સ્થાનિક ઉત્પાદનોને સૌથી વધુ પ્રાથમિકતા આપવાની છે.

**ભારતીય રહ્મતો:** સંખ્યાબંધ દેશોમાં મધ્યખમને ભારે લોકપ્રિયતા મળી રહી છે. અમેરિકાના ઘણા સ્થળોએ મધ્યખમ તાલિમ કેન્દ્રો ચાલી રહ્યાં છે. જર્મની, પોલેન્ડ અને મલેશિયા સહિત લગભગ 20 દેશોમાં મધ્યખમની લોકપ્રિયતામાં વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં જ, તેની વર્લ્ડ ચેમ્પિયનશિપ ચોજવામાં આવી હતી અને સંખ્યાબંધ દેશોએ આ પ્રતિરૂપધર્માં ભાગ લીધો હતો.

**આપણા બહાદુર જવાનો:** જેમને દેશની સુરક્ષા માટે ફરજ નિભાવવા સરહદો પર તૈનાત કરવામાં આવ્યા છે તેવા આપણા બહાદુર જવાનોનો આપણે અવશ્ય વિચાર કરવો જોઈએ. તેમના માનમાં આપણે ઘરે એક દીવો પ્રગટાવવાનો છે.

**ઓક્સાકા ખાદી:** ખાદીને ઇકો ફેન્ડલી ઉત્પાદન તરીકે વ્યાપક સ્વીકૃતિ મળી રહી છે અને તેને હવે ફેશનનો હિસ્સો પણ બની ગઈ છે. ખાદીની લોકપ્રિયતા વધવાની સાથે સાથે, દુનિયાના સંખ્યાબંધ પ્રદેશોમાં તેનું ઉત્પાદન પણ થવા લાગ્યું છે. મેક્સિકોમાં ઓક્સાકા નામની એક જગ્યા છે જ્યાં સંખ્યાબંધ ગામડાંમાં લોકો ખાદીનું ઉત્પાદન કરે છે મેક્સિકોના ઓક્સાકા ગામમાં માર્ક બ્રાઉને લોકોને ખાદીથી અવગત કરાવ્યા અને તેમને ખાદીનું ઉત્પાદન કરવા માટે તાલીમ આપી હતી. હવે, ઓક્સાકા ખાદી એક બ્રાન્ડ બની ગઈ છે.

**ચાત્રાધામની પરંપરા:** ભારતમાં ચાત્રાધામ આપણને સૌને એક તાતણે બાંધે છે. મોટાભાગે લોકો પવિત્ર સ્નાન કરતી વખતે મંત્રનો જાપ કરે છે કે—

ગંગે! ચ યમુને! ચૈવ ગોદાવરી! સરસ્વતિ! નર્મદે! સીધુ!  
કાવેરિ! જલે અસ્મિન્ સનિર્ધી કુરુ  
તેવી જ રીતે, શીખોના પવિત્ર ધામ 'નાંદેં સાહિબ'  
અને 'પટના સાહિબ' છે. આપણા શીખ ગુરુઓએ

પણ તેમના જીવન અને ઉમદા કાર્યોથી આપણામાં એકતાની ભાવનાને વધુ બળવાન કરી છે.

**વાટિમકી જયંતિ:** હું મહિષિ વાટિમકીને હૃદયપૂર્વક વંદન કરું છું અને આ વિશેષ પ્રસંગે તમામ દેશવાસીઓને દિલથી શુભેચ્છા પાઠવું છું. તેઓ લાખો ગરીબો અને દસ્તિઓ માટે આશાનું કિરણ હતા... હજુ પણ સૌને તેમનામાં આશા અને વિશ્વાસ છે.

**સરદાર પટેલની સ્મૃતિ:** આપણે સરદાર પટેલના વ્યક્તિત્વ અંગે સંખ્યાબંધ પાસાઓ પર ચર્ચા કરી છે પરંતુ શું તમે જાણો છો કે, તેમનામાં ખૂબ જ સારી રમ્ભજવૃત્તિ પણ હતી? બાપુ કહેતા હતા કે, સરદાર પટેલની રમ્ભજી વાતોથી તેમને એટલું બધું હસવું આવતું કે હસીને પેટમાં દુઃખવા લાગે. આવું ફક્ત એકાદ વખત નહોંતું બંન્યું પરંતુ દિવસમાં કેટલીય વખત બનતું હતું. અંદ ભારતનું નિર્માણ કરવાના તેમના પ્રચારો બદલ પણ આપણે હંમેશા તેમના ખૂબ જ કૃતજ્ઞ રહીશું.

**પેનિસલ ગામ:** જ્યારે આખા દેશના વિદ્યાર્થીઓ તેમનું ગૃહકાર્ય કરી રહ્યાં હોય અથવા કાગળમાં નોંધ લઈ ત્યારે તેમના આ લખાણ પાછળ ક્યાંકને ક્યાંક પુલવામાના લોકોનો સખત પરિશ્રમ રહેલો હોય છે! કાશ્મીર ખીણાનો પ્રદેશ દેશની પેનિસલ સ્લેટ એટલે લાકડાના કાસ્ટિંગની 90% માંગ પૂરી પાડે છે. આમંથી ખૂબ જ મોટી સંખ્યામાં જથ્થી પુલવામાનો હોય છે. પુલવામાનું ઔખુ ગામ પેનિસલ ગામ તરીકે ઓળખાય છે.

**કૃષિ:** કૃષિ ક્ષેત્રમાં ખુલેલી નવી સંભાવનાઓ યુવાનોને આ ક્ષેત્ર તરફ આકર્ષી રહી છે. ટેકનોલોજી આધારિત સેવાઓએ ઝારખંડ અને મધ્યપ્રદેશમાં કૃષિ ઉત્પાદનોની હોમ ડિલિવરી સંભવ બનાવી છે. અન્ય એક નવી શરૂઆતરૂપે, મહારાષ્ટ્રની એક કંપની ખેડૂતોના દિલ જીતવા માટે તેમને બોનસ આપી રહી છે.

QR કોડ સ્કેન કરીને મન કી બાત સાંભળો

[https://www.youtube.com/watch?time\\_continue=3&v=CECeMxOxt-Q&feature=emb\\_logo](https://www.youtube.com/watch?time_continue=3&v=CECeMxOxt-Q&feature=emb_logo)



# ન્યૂ ઇન્ડિયા

# સમાચાર

વર્ષ : 1, અંક : 10

16-30 નવેમ્બર, 2020

## ન્યૂ ઇન્ડિયા

સંપાદક:  
કુલશીલ પટિંહ ઘતવાલિયા,  
મુખ્ય મહાનિર્દેશક,  
પીરાઈબી, નવી દિલ્હી

પરામર્શ સંપાદક  
વિનોદ કુમાર

સહાયક પરામર્શ સંપાદક  
શરતકુમાર શર્મા

પ્રોફેશનલ ડિઝાઇનર  
રવિંદ્ર કુમાર શર્મા

પ્રકાશક અને મુદ્રક:  
સાલેન્ડ પ્રકાશ,  
મહાનિર્દેશક, BOC  
બ્યૂરો ઓફ આઇટરીય  
એન્ડ કમ્યુનિકેશન વતી

મુદ્રણ:  
વિભા પ્રેસ (પ્રા.) લિમિટેડ  
સી-66/3, ઓખલા ઇન્ડસ્ટ્રીયલ એરિયા,  
કેર્ન-2, નવી દિલ્હી-110020

બ્યૂરો ઓફ આઇટરીય  
એન્ડ કમ્યુનિકેશન  
નીજો માટે, માહિતી ભવન,  
નવી દિલ્હી - 110003  
ખાતેથી પ્રકાશિત

NEW INDIA SAMACHAR   

RNI No.: DELGUJ/2020/78810

 response-nis@pib.gov.in

» 1	તંત્રીલેખ	પૃષ્ઠ 02
» 2	આપના પત્રો	પૃષ્ઠ 03
» 3	સંક્ષિપ્ત સમાચાર	પૃષ્ઠ 04-05
» 4	વિશેષ અહેવાલઃ બંધારણ દિવસ	પૃષ્ઠ 06-12
» 5	કોરોના સામે જંગ	પૃષ્ઠ 13
» 6	વાચુ પ્રદૂષણઃ વાર્ષિક પુનરાવર્તન	પૃષ્ઠ 14-16
» 7	મુખ્ય યોજનાઃ પ્રધાનમંત્રી આવાસ યોજના	પૃષ્ઠ 17-19
» 8	કવર સ્ટોરીઃ અટલ ઈનોવેશન મિશન	પૃષ્ઠ 20-25
» 09	વિજ્ઞાનઃ ચુવાધનને શિક્ષણ	પૃષ્ઠ 26-28
» 10	વ્યક્તિત્વઃ સી.વી.રામન	પૃષ્ઠ 29
» 11	ગુજરાતની મુલાકાતે પ્રધાનમંત્રીઃ રાષ્ટ્રીય એકતા દિવસ	પૃષ્ઠ 30-31
» 12	ઉરિત ઉર્જાઃ આંતરરાષ્ટ્રીય સૌર સંગ્રહન	પૃષ્ઠ 32-33
» 13	મંત્રીમંડળના નિર્ણયો	પૃષ્ઠ 34-35
» 14	સરકારાત્મક અભિગમઃ બદલાતું ભારત	પૃષ્ઠ 36

# તंત्रीની કલમે

સાદર નમસ્કાર,

વિકાસ માટે નવનિર્માણ એક મુખ્ય જરૂરિયાત છે અને જ્યુ ઈન્ડિયા સમાચારના આ અંકમાં અમારા વાચકો સમક્ષ, 2014થી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ આપણા શિક્ષાન્તર, ઉત્સાહ અને પ્રત્યેક વિચાર પ્રક્રિયાઓમાં નવાચારને હિસ્સો બનાવવા માટેના વધતા પ્રયાસો પર પ્રકાશ પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. 26 નવેમ્બરે દેશ છઢા બંધારણ દિવસની ઉજવણી કરી રહ્યો હોવાથી આ અંકમાં ભારતના બંધારણના ઘડતર પાછળની કહાની ઉપરાંત, વિકાસના પથ પર પ્રગતિ સંબંધિત કહાનીનો પણ સમાવી લેવામાં આવી છે.

અટલ ઈનોવેશન મિશન પર આધારિત કવર સ્ટોરીમાં દસ લાખ બાળકોને 'નિઓટ્રિક ઈનોવેટર્સ' તરીકે ઉછેરવાની દૂર્દેશી રજૂ કરવામાં આવી છે. અટલ ઈનોવેશન મિશન સમગ્ર ભારતની શાળાઓમાં અટલ ટિકરિંગ લેબોરેટરીઓની સ્થાપના કરી રહ્યું છે.

બંધારણ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી ભારતના બંધારણને આદર આપી રહ્યા છે તેની સચિત્ર રજૂઆત કરવામાં આવી છે.

વિજ્ઞાન સેતૂ આધારિત વાતમાં એ જણાવવામાં આવ્યું છે કે, કેવી રીતે નવા નવાચારો સરકારના વિકાસપથમાં અને કૃષિને સૌથી મોટા લાભાર્થી બનાવવામાં મદદરૂપ થઈ રહ્યાં છે.

દેરેક શિયાળાની શરૂઆતમાં ખાસ કરીને દિલ્હી-NCR પ્રદેશ અને તેના પડોશી રાજ્યો સહિત દેશના અન્ય ભાગોમાં ખેતરોમંથી પાક લણ્યા પણી પરાળ (પાકનો બાકી રહેલો કચરો) સળગાવવાથી વારંવાર વાયુ પ્રદૂષણ ફેલાવાથી સ્થિતિ જે પ્રકારે વધુ દુષ્કર બનતી જાય છે તેને રોકવા માટે સરકાર દ્વારા કેટલાક પગલાં લેવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સૌર સંગ્રહન સરકારની સ્વરચ્છ ઉર્જા પ્રત્યેની કટિબદ્ધતા અને કેવી રીતે ભારત પોતાના આ પ્રયાસોમાં આંતરરાષ્ટ્રીય સમુદ્દરાય સાથે કામ કરી રહ્યું છે તે અંગે વાત કરે છે.

મુખ્ય યોજનામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાને સમાવી લેવામાં આવી છે જેમાં તમામ પરિવારોને પોતાનું ઘર આપવાની સરકારની પ્રતિબદ્ધતા અંગે જણાવાયું છે. જમ્મુ અને કાશ્મીર તેમજ કૃષિ અંગે મંત્રીમંડળ દ્વારા લેવામાં આવેલા મહત્વના નિર્ણયો સારા સુશાસન પ્રત્યે સરકારની કટિબદ્ધતા દરખાયે છે. ભારતની સકારાત્મક કહાનીઓને નિયમિત વિશેષ વાંચન સામગ્રી તરીકે આપવામાં આવી છે. આ અંકમાં ભારત રટન શ્રેણીમાં વેજાનિક ડૉ. સી.વી.રામનની વિશેષ વાતો ટાંકવામાં આવી છે.

ઇમેલ દ્વારા આપ સૌના તરફથી વિપુલ પ્રમાણમાં મળી રહેલા પ્રોત્સાહક પ્રતિભાવોને અનુલક્ષીને, આ અંકથી અમે નવા વિશેષ વાંચનનો વિભાગ શરૂ કરી રહ્યા છીએ. આ વિભાગમાં આપના તરફથી મળેલા કેટલાક પ્રતિભાવોને સમાવી લેવામાં આવ્યા છે. આપના પ્રતિભાવોની અમે આતુરતાપૂર્વક પ્રતિક્ષા કરીએ છીએ.

કૃપા કરીને આપના પ્રતિભાવો અહીં મોકલો:

**સરનામું : બ્યૂરો ઓફ આઉટરીચ એન્ડ કમ્યુનિકેશન, બીજો માળ, માહિતી ભવન,**

**નવી દિલ્હી – 110003**

**ઇમેલ : response-nis@pib.gov.in**

આપના આશીર્વાદ સાથે,

  
કે.એસ. ધતવાલિયા



## આપના પત્રો

ન્યૂ ઇન્ડિયા સમાચાર મેળવીને તેમજ ભારતમાં હાથ ધરવામાં આવી રહેલી વિકાસની મહત્વપૂર્ણ કામગીરીઓ અંગેની માહિતી મેળવીને ખૂબ જ આનંદ થયો. હું હંમેશા જાપાનમાં અમારી "ડિસ્કવર ઇન્ડિયા કલબ" (D I C)ના સભ્યો સાથે આ સામયિક શેર કરું છું. આ કલબ સાત વર્ષ પહેલાં ભારત તેમજ જાપાનની સંસ્કૃતિ અને લોકો વરચેના સંબંધોને પ્રોત્સાહન આપવા માટે સ્થાપવામાં આવી હતી. હું એવી પણ ભલામણ કરવા માંગું છું કે, આ સામયિક જાપાનમાં આવેલા જાપાન ભારત સંગઠનને જો અત્યાર સુધી ના મોકલવામાં આવ્યું હોય તો, મોકલવું જોઈએ. તેમની વેબસાઈટ છે:

<https://www.japan-india.com/english>



rabindermalik@hotmail.com

અલગ અલગ મુદ્દાઓનું વ્યાપક કવરેજ આપવા બદલ હું ન્યૂ ઇન્ડિયા સમાચારનો આભાર વ્યક્ત કરું છું. એક કિલક કરવાથી પાનું બદલાતી આ સામયિકના માળખાની શૈલી તેને વાંચવામાં વધુ આનંદદાયક અનુભવ આપે છે. અનુક્રમણિકાના પાના પર કૃપા કરીને હાઇપરલિંક પૂરી પાડો જેથી વાંચક જે-તે પાના પર સીધા જ પહોંચી શકે.

ભાષાની પસંદગી મને ઈમેલ પર બહુ રૂપદ્વારા થઈ નહોતી. અંગેજમેન્ટ્સ મેં ઘણી વાત આ વાંચ્યું છે. સતત સારું કામ કરતા રહે.



બાલ ત્રિવેદી – હ્યુસ્ટન, ટેક્સાસ, USA -  
baltrivedi@gmail.com



આ ખરેખર ખૂબ સારું કામ છે અને ન્યૂ ઇન્ડિયા સમાચારના લેખો અમારા સૌના માટે ખૂબ જ રસપ્રદ તેમજ માહિતીસભર હોય છે. ખૂબ ખૂબ આભાર.

savitapal97@gmail.com



મેં આ સામયિકનો તાજેતરનો જ અંક એટલેકે 1 થી 15 નવેમ્બર 2020નો અંક વાંચ્યો. તે ખૂબ જ સારો હતો અને થોડી જગ્યામાં જ વિગતવાર પ્રેઝન્ટેશન આપ્યું હતું. તમામ ક્ષેત્રો માટે આ સારું પ્રકાશન છે. કૃપા કરીને આવી જ લાગણી સાથે તેને સતત ચાલુ રાખો. રાષ્ટ્રભક્તિના આ સામયિકને મારી ખૂબ જ શુભેચ્છાઓ.

ritabrata446@gmail.com



મારું નામ એસ. રામક્રિશ્ન છે અને હું તેલંગાણાથી છું. મેં ગયા અંકથી જ ન્યૂ ઇન્ડિયા સમાચાર વાંચવાનું શરૂ કર્યું છે. આ ઉત્તમ કામગીરી બદલ હું આપને અભિનંદન પાઠવું છું. આ પખવાડિક સામયિક પ્રકાશિત કરવાના તમારા પ્રયાસો ખૂબ જ અદ્ભૂત છે. તેને પ્રાદેશિક ભાષાઓમાં પણ પ્રકાશિત કરવા બદલ ખૂબ આભાર. આગામી તહેવારોની મોસમ માટે આપ સૌને મારી શુભેચ્છાઓ.

siddamramakrishna@gmail.com

## દુર્ગમ વિસ્તારોમાં માર્ગ નિર્માણનું કાર્ય વેગવાન બન્યું

**ડુર્ગમ** જન્મીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિહે 12 ઓક્ટોબર, 2020ના રોજ 44 મહિન્દુપૂર્ણ સ્થાયી પૂલોનું લોકાર્પણ કર્યું હતું. તેના કારણે દેશના પશ્ચિમ, ઉત્તર અને પૂર્વોત્તર વિસ્તારોમાં માર્ગ નિર્માણનું કાર્ય વેગવાન બન્યું છે, જે સંરક્ષણાની સાથે સાથે વ્યૂહાત્મક મહિન્દુ પણ ધરાવે છે. 30 થી 484 મીટર સુધીની લંબાઈ ધરાવતાં આ પૂલો નાગરિકોને પરિવહન સુવિધા પૂરી પાડવાની સાથે સાથે તેમને તેમની આકાંક્ષાઓ પરીપૂર્ણ કરવામાં મદદરૂપ સાબિત થશે. સીમા માર્ગ સંગરન (BRO) દ્વારા નિર્મિત આ પૂલો સાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આવેલા છે, જેમાં જમ્મુ અને કાશ્મીરના દસ પૂલોનો પણ સમાવેશ થાય છે.

આ ઉપરાંત સંરક્ષણ મંત્રીએ અરુણાચલ પ્રદેશના તવાંગ ક્ષેત્રને જોડતી વ્યૂહાત્મક રીતે મહિન્દુપૂર્ણ નેચિપુ સુરંગની પણ આધારશીલા



મૂકી હતી. ઝોકિલા સુરંગની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે, જે પૂર્ણ થયા પછી શ્રીનગર ખીણ અને લેહથી ક્રાસ અને કારગીલ વચ્ચે તમામ અંતુઓમાં કાર્યરત રહી શકે તેવો માર્ગ તૈયાર કરશે. 15 ઓક્ટોબર, 2020ના રોજ આ

સ્થળે ઔપચારિક વિસ્ફોટ કરાયો હતો. 14.15 ડિ.મી. લાંબી સુરંગ ઝોકિલા પાસ પસાર કરવાનો સમય ઘટાડીને માત્ર 15 મિનિટ કરી દેશો, જેની મુસાફરીમાં અત્યારે 3.5 કલાક જેટલો સમય લાગે છે.

## જી પરીક્ષણ માટે નવીન ઉપાય: ભોબાઇલ લેબોરેટરી!

**જી** વચ્ચ અને સલામત પાણીનો પૂર્વપઠો જાહેર આરોગ્ય માટે અત્યંત મહિન્દુપૂર્ણ છે જેના માટે નિયમિત પરીક્ષણ કરવું ફરજિયાત છે. આથી, પાણીની ગુણવત્તાનું નિરીક્ષણ અને દેખરેખ જલ જીવન મિશનના સ્વાભાવિક અને અંતરિક ઘટકો છે. આ હેતુ પૂર્ણ કરવા માટે હરિયાણા સરકારે આગામી વિશિષ્ટતાઓ ધરાવતી સ્વદેશી બનાવટની મોબાઇલ જળ પરીક્ષણ લેબોરેટરી શરૂ કરી છે. આ લેબોરેટરીમાં એનાલાઇઝર, સેન્સર, પ્રોબ્સ, પાણીના પરીક્ષણ માટે બનાવેલા સાધનોનો સમાવેશ કરતી બહુ-માનકીય વ્યવસ્થાનો સમાવેશ થાય છે. હરિયાણામાં પાણીની ગુણવત્તા સંબંધિત મુખ્ય સમસ્યા કુલ ક્રાવ્ય કચરો (TDS), ફલોરાઇટ, નાઈટ્રોટ, આર્થન અને ક્ષારીયતા છે.

આ લેબના સ્થાન ઉપર દેખરેખ રાખવા તેને GPS-સક્ષમ



કરવામાં આવી છે. વધુમાં તે સંપૂર્ણપણે સ્વચ્છાસંચાલિત, સેન્સર આધારિત એનાલાઇઝર ધરાવે છે, જે કેન્દ્રીય રીતે સંચાલિત સોફ્ટવેર દ્વારા નિયંત્રિત થાય છે. વિશ્લેષણના પરિણામો વાનમાં લગાવેલી LED પેનલ ઉપર તરત ૪ પ્રદર્શિત કરવામાં આવે છે.

## ખરકારની સ્વિગી - શેરીના ખાણી-પીણી વિકેતાઓનો ક્ષ્યાદ ઓનલાઇન ભાણી શકાશે



**પ્ર**ધાનમંત્રી શેરી વિકેતા આત્મનિર્ભર નિધી (પીએમ સ્વનીધિ) યોજનાના ભાગરૂપે આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે (MoHUA) ભારતના અગ્રણી ફુડ ઓર્કર્સિંગ અને ડિલિવરી પ્લેટફોર્મ સ્વિગી સાથે એક MoU કર્યો છે. તે શેરીના ખાણી-પીણી વિકેતાઓને ઈ-કોમર્સ પ્લેટફોર્મ પૂર્ણ પાડશે, જેના થકી તેઓ પોતાની પહોંચ હજારો ગ્રાહકો સુધી વિસ્તારી શકશે અને આ પહેલ તેમનો વેપાર વધારવામાં મદદરૂપ સાબિત થશે. ચેપનો ફેલાવો અટકાવવા માટે શારીરિક અંતર જાળવવું મહિન્દ્રાય રોજગાર અભિયાન (GKRA) શરૂ કરવામાં આવ્યું હતું. 15 ઓક્ટોબર સુધી, આ યોજના અંતર્ગત 33 કરોડ માનવ-દિનોની રોજગારીનું સર્જન કરવા માટે 3. 33,000 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ યોજનાના ભાગરૂપે હાથ ધરવામાં આવેલી કામગીરીમાં આશરે 1,40,000 જળ સંરક્ષણ બાંધકામો, 4,31,640 ગ્રામીણ આવાસો, 38,287 પશુધન તબેલા, 26,459 ખેત તલાવડીઓ અને 17,935 સમુદ્દ્રાય સ્વરચ્છતા પરિસરોનો સમાવેશ થાય છે. જિલ્લા ખનન ભંડોળ થકી કુલ 7,816 કામગીરીઓ હાથ ધરવામાં આવી છે, 2,123 ગ્રામ પંચાયતોને ઈન્ટરનેટ જોડાણ પૂર્ણ પાડવામાં આવ્યું છે અને ઘન અને પ્રવાહી કચરાના વ્યવસ્થાપન સંબંધિત 22,592 કામો હાથ ધરવામાં આવ્યાં હતાં. વધુમાં, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો મારફતે 65,374 લોકોને કૌશલ્ય તાલીમ પૂરી પાડવામાં આવી છે.

## ચર્મ કારીગરો માટે ખેપ શરૂ કરાઈ

**પો**તાની તમામ સેવાઓમાં સંકલિત ગુણવત્તા ખાતરી માટે એકમાત્ર મંચ પ્રદાન કરવા માટે ચર્મ ક્લેત્ર કૌશલ્ય પરિષદ (LSSC) દ્વારા ચર્મ કારીગરો માટે કૌશલ્ય પ્રમાણીકરણ મૂલ્યાંકન (SCALE) ભારત એન્ફોઇંડ એપનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ વિશિષ્ટ પહેલ કૌશલ્યવર્ધન, પ્રશિક્ષણ, મૂલ્યાંકન અને ચર્મ અને ચર્મ ઉત્પાદ ઉદ્યોગના રોજગારની જરૂરિયાતો માટે કેન્દ્રીકૃત નિરાકરણ પૂર્ણ પાડવાનો હેતુ ધરાવે છે.

## GKRA: રોજગારીની ખાતરી, ગામડાંઓનો વિકાસ



**કો**વિડ-19 મહામારીના કારણે 6 રાજ્યોમાં 116 જિલ્લાઓમાં પોતાના ગામડાંઓમાં પરત ફરી રહેલા સ્થળાંતરિત કામદારો અને ગ્રામીણ વિસ્તારોમાં અન્ય સમાન રીતે પ્રભાવિત થયેલા નાગરિકો માટે રોજગારીની તકોનું સર્જન કરવા માટે ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન (GKRA) શરૂ કરવામાં આવ્યું હતું. 15 ઓક્ટોબર સુધી, આ યોજના અંતર્ગત 33 કરોડ માનવ-દિનોની રોજગારીનું સર્જન કરવા માટે 3. 33,000 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ યોજનાના ભાગરૂપે હાથ ધરવામાં આવેલી કામગીરીમાં આશરે 1,40,000 જળ સંરક્ષણ બાંધકામો, 4,31,640 ગ્રામીણ આવાસો, 38,287 પશુધન તબેલા, 26,459 ખેત તલાવડીઓ અને 17,935 સમુદ્દ્રાય સ્વરચ્છતા પરિસરોનો સમાવેશ થાય છે. જિલ્લા ખનન ભંડોળ થકી કુલ 7,816 કામગીરીઓ હાથ ધરવામાં આવી છે, 2,123 ગ્રામ પંચાયતોને ઈન્ટરનેટ જોડાણ પૂર્ણ પાડવામાં આવ્યું છે અને ઘન અને પ્રવાહી કચરાના વ્યવસ્થાપન સંબંધિત 22,592 કામો હાથ ધરવામાં આવ્યાં હતાં. વધુમાં, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો મારફતે 65,374 લોકોને કૌશલ્ય તાલીમ પૂરી પાડવામાં આવી છે.


## નોકરી માટે ઈન્ટરવ્યુ પ્રથા નાખૂં કરાઈ

**કુ**ન્ને સરકારમાં 2016માં જૂથ-બી (બિન-રાજ્યપત્રિત) અને જૂથ-સીના હોક્ઝાઓ માટે ઈન્ટરવ્યુ પ્રથા નાખૂં કરાયા બાદ હવે 23 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોમાં નોકરીઓમાં ઈન્ટરવ્યુ પ્રથા નાખૂં થઈ ચૂકી છે. 15 ઓગસ્ટ, 2015ના રોજ લાલ કિલ્લા ઉપરથી રાષ્ટ્રજોગ સંબોધન કરતી વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈન્ટરવ્યુ પ્રથા નાખૂં કરવાનું અને માત્ર લેખિત પરીક્ષાના આધારે ઉમેદવારોની પસંદગી કરવાનું સૂચન કર્યું હતું. પ્રધાનમંત્રીએ આપેલી સલાહનો ઝડપી અમલ કરતાં કાર્બિક અને પ્રશિક્ષણ વિભાગે તાબકતોક કવાયત હાથ ધરી હતી અને કેન્દ્ર સરકારની ભરતીઓમાં ઈન્ટરવ્યુ પ્રથા નાખૂં કરવા માટે માત્ર ત્રણ મહિનામાં સમગ્ર પ્રક્રિયા પૂરી કરી હતી. ■

# દેશનું બંધારણા

## ભારતનો પવિત્ર ગ્રંથ

આપણો, ભારતના  
લોકોએ 26 નવેમ્બર,  
1949ના રોજ બંધારણા  
અપનાખ્યું હતું. રાજ્ય  
માટે આ તારીખ ખૂબ જ  
મહત્વ ધરાવતી હોવા  
ઇતાં, છેક 2015માં  
સરકારે આપણાં  
બંધારણાના મુખ્ય  
શિલ્પી બાબાસાહેબ  
ભીમરાવ અંબેડકરને  
શ્રદ્ધાંજલિ સ્વપૃષ્ઠે દર  
વર્ષ 26 નવેમ્બરનો  
દિવસ 'બંધારણા દિન'  
તરીકે ઉજવવાનો  
નિર્ણય લીધો હતો.



**સે** ક્ષાંતિક રીતે, બંધારણા મૂળભૂત સિદ્ધાંતોનો  
અત્યંત મહત્વપૂર્ણ સમૂહ છે જે દેશની સરકારને  
માર્ગદર્શન પૂરું પાડે છે. તે દેશના નાગરિકોના  
અધિકારો અને તેમનું આત્મસન્માન સુનિશ્ચિત કરે છે  
અને રાષ્ટ્રની એકત્ર અખંડિત રાખે છે. દેરેક દેશ માટે  
બંધારણા તેનો આત્મા છે. દેશના સ્વતંત્રતા સંઘર્ષમાં  
આપણાં સ્વાતંત્ર્ય સેનાનીઓને માર્ગદર્શન પૂરી પાડતી  
ભાવનાઓનું પ્રતિબિંબ રજૂ કરતું હોવાથી આ હકીકત  
ભારતને વધુ સચોટ રીતે લાગુ પડે છે. તેના ઘડવૈયાઓના  
વિચકાર બુઝિયાતુર્યના કારણે ભારતીય બંધારણા

સરકારનો અંતરાત્મા જાળવી રાખે છે અને દેશના  
લોકશાહી માળખાંને સંરક્ષણ પૂરું પાડે છે. ભારતના  
બંધારણાને 26 નવેમ્બર, 1949ના રોજ સ્વીકારવામાં  
આવ્યું હતું અને તેની કેટલીક જોગવાઈઓ તાત્કાલિક  
અમલમાં આવી હતી અને બાકીની જોગવાઈઓ 26  
જાન્યુઆરી, 1950ના રોજ અમલમાં આવી હતી.

દર વર્ષ દેશમાં 15 ઓગસ્ટ (સ્વતંત્રતા દિન) અને 26  
જાન્યુઆરી (પ્રજાસત્તાક દિન)ની ઉત્સાહપૂર્વક ઉજવણી  
કરવામાં આવે છે. પરંતુ 26મી નવેમ્બર તરફ અત્યાર  
સુધી ખાસ દ્યાન આપવામાં આવ્યું નથી. કેન્દ્રમાં સત્તા

સંભાવ્યાં પછી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેના મહિને છાજે તે રીતે આ દિવસ ઉજવવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણય પાછળનો તેનો હેતુ નવી પેઢી બંધારણાના મહિને વિશે સજાગ બનાવવાનો અને નવા ભારતના નિર્માણમાં તેના પ્રદાનને વધારે સારી રીતે સમજવામાં મદદ કરવાનો છે.

આ નિર્ણય બંધારણાના મુખ્ય ઘડકેયા ભીમરાવ આંબેડકરને તેમની 125મી જન્મજંતિ નિમિતે શ્રીજાંજલી સ્વરૂપે લેવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે બંધારણાની ડ્રાફ્ટિંગ સમિતિના અધ્યક્ષ તરીકે ભારતના બંધારણાના નિર્માણમાં ડૉ. આંબેડકરે ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 26 નવેમ્બરની ઉજવણીનો અર્થ તે નથી કે 26 જાન્યુઆરી તેનું મહિને ગુમાવી દેશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત જેવા વૈવિધ્યસભર દેશમાં, તે ખૂબ જ મહિને પૂર્ણ બાબત છે કે ભારતના લોકોને બંધારણાની જોગવાઈઓ વિશે જાગૃત



પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 11 ઓક્ટોબર, 2015ના રોજ મુંબઈમાં ચોજાયેલા કાર્યક્રમમાં દર વર્ષે 26 નવેમ્બરના રોજ બંધારણ દિવસ ઉજવવાની જાહેરાત કરી હતી.

## શ્રેષ્ઠતમ પસંદગી

**મારણા** રતના બંધારણમાં વિશ્વના અનેક દેશોના બંધારણનું પ્રતિબિંબ જોવા મળતું હોવા છતાં તે ભારત માટે કાયદાનો દેશોના બંધારણોનો ગહન અભ્યાસ કર્યો હતો. ગવર્નર્ન્સ ઓફ ઇન્ડિયા એક્ટ, 1935નું મૂળભૂત માળખું જાળવી રાખીને ભારતના બંધારણે બ્રિટન, આયર્લેન્ડ, અમેરિકા, દક્ષિણ આફ્રિકા, કેનેડા, ફાન્સ, ઓસ્ટ્રેલિયા, રશીયા, જર્મની અને જપાનમાંથી કેટલીક જોગવાઈઓ અપનાવી છે. સંદીય માળખું, રાજ્યપાલનો હોક્ષો, ન્યાયતંત્ર, જાહેર સેવા આયોગ, કટોકટીની જોગવાઈઓ, વહીવટી વિગતો ગવર્નર્ન્સ ઓફ ઇન્ડિયા એક્ટ, 1935માંથી લેવામાં આવી છે. આમુખમાં પ્રજાસત્તાક, સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાના આદર્શો ફાન્સના બંધારણમાંથી લેવામાં આવ્યાં છે. આમુખની ભાષા ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી લેવામાં આવી છે અને આમુખની શૈલી અમેરિકાના બંધારણમાંથી અપનાવવામાં આવી છે.

**કઈ બાબત તેને વિશ્િષ્ટ બનાવે છે:** ભારતનું બંધારણ તમામ લોકોને સમાનતા પૂરી પાડે છે અને કાયદાના શાસનની જોગવાઈ કરે છે. તે દરેક અને પ્રત્યેક નાગરિકને મૂળભૂત અધિકારોની ખાતરી આપે છે, ભલે તે વંચિત હોય અથવા શોષિત હોય, પણત હોય કે ગરીબ હોય. તે તેમના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરે છે અને તેમના હિતોને સલામત રાખે છે.

**સુધારાની જોગવાઈઓ:** સુધારાની જોગવાઈ બંધારણને વધારે પરિવર્તનશીલ બનાવે છે. બંધારણના ઘડકેયાઓ તે વાત સારી રીતે જાણતાં હતાં કે સમયના પરિવર્તન સાથે બંધારણમાં પણ સુધારો કરવાની જરૂરિયાત ઊભી થશે. આથી, તેમણે શાસકો સ્વરંધરી સુધારાઓ હાથ ન ધરી શકે તે બાબતનો ખ્યાલ રાખીને બંધારણ સુધારવાની વિગતવાર પ્રક્રિયા પૂરી પાડી છે. અત્યાર સુધી બંધારણે કુલ 104 સુધારાઓ જોયા છે, જેમાં છેલ્લો સુધારો જાન્યુઆરી, 2020માં કરાયો છે.



## બંધારણ સભાની સમિતિઓ

વિવિધ મહિંપૂર્ણ મુદ્દાઓ ઉપર બંધારણ સભા દ્વારા સતર અલગ-અલગ સમિતિઓની રચના કરવામાં આવી હતી.

સમિતિનું નામ	અધ્યક્ષ
પ્રક્રિયાના નિયમો અંગે સમિતિ	રાજેન્ડ્ર પ્રસાદ
સ્ટારિંગ સમિતિ	રાજેન્ડ્ર પ્રસાદ
નાણાં અને કર્મચારીઓના સમિતિ	રાજેન્ડ્ર પ્રસાદ
ઓળખપત્ર સમિતિ	અધ્યાતી કિષણ સ્વામી ઐથર
ગૃહ સમિતિ	બી. પણ્ણાભી સીતારમથ્યા
કાર્ય સંચાલન સમિતિ	કે. એમ. મુનસી
રાજ્યધંજ પર કામચલાઉ સમિતિ	રાજેન્ડ્ર પ્રસાદ
બંધારણ સભાની કામગીરી સંબંધિત સમિતિ	જી. વી. માવલંકર
રાજ્યોની સમિતિ	જવાહેરલાલ નહેરુ
મૂળભૂત અધિકારો, લઘુમતિઓ અને આદિવાસી અને નિષ્કાસિત વિસ્તાર અંગે સલાહકારી સમિતિ	વધુભભાઈ પટેલ
લઘુમતીઓની પેટા-સમિતિ	એચ. સી. મુખર્જી
મૂળભૂત અધિકારોની પેટા-સમિતિ	જી. બી. કિપલાની
પૂર્વોત્તર સિમાવતી આદિજાતિ વિસ્તારો અને આસામ નિષ્કાસિત અને આંશિક નિષ્કાસિત વિસ્તારોની પેટા-સમિતિ	ગોપિનાથ બાર્ડોલોઇઝ
નિષ્કાસિત અને આંશિક નિષ્કાસિત વિસ્તારોની (આસામમાં સમાવિષ્ટ હોય તેવા સિવાય) પેટા-સમિતિ	એ. વી. ઠક્કર
કેન્દ્રીય સત્તા સમિતિ	જવાહેરલાલ નહેરુ
કેન્દ્રીય બંધારણ સમિતિ	જવાહેરલાલ નહેરુ
દ્રાફ્ટિંગ સમિતિ	બી. આર. આંબેકર

બનાવવામાં આવે. તેમણે જણાવ્યું હતું કે, 26 નવેમ્બરની બંધારણ દિન તરીકે ઉજવણી તે બાબતનું પ્રતિબિંબ રજૂ કરે છે કે કેન્દ્ર સરકાર પણ તે દિશામાં વિચારે છે તથા સમયની સાથે સાથે આ જ્યાલ વિકાસ પામશે. 26 નવેમ્બર, 2017ના રોજ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, "સ્વતંત્રતા બાદ જ્યારે કરોડો લોકો નવી આશા સાથે જીવનમાં આગળ વધવાનું સ્વપ્ન સેવતાં હતા અને તે સમયે પ્રવર્તમાન કપરા સંજોગોમાં પણ તેમનો જૂસ્સો આસમાને હતો, તેવા સમયે તમામને સ્વીકાર્ય બને તેવું બંધારણ આપવાનું કાર્ય સરળ નહોતું. તેવા દેશમાં કે જ્યાં સંખ્યાબંધ ધર્મ પાળતાં લોકો વસે છે, સેંકડો ભાષાઓ બોલાય છે અને 1,700થી વધારે બોલીઓ છે, જ્યાં વિશિષ્ટ શ્રદ્ધા ધરાવતાં લોકો શહેરો અને નગરો ઉપરાંત જંગલોમાં પણ વસે છે, ત્યારે તે તમામ લોકોને એક મંચ ઉપર લેગા કરવા અને તેમની શ્રદ્ધાનું સંનમાન થાય તે રીતે આ ચૈતિહાસિક દસ્તાવેજ તૈયાર કરવાનું કાર્ય સરળ નહોતું."

બંધારણ અપનાવવામાં આવ્યું અને તેનો અમલ કરવામાં આવ્યો તે પહેલાં ભારતનું શાસન બ્રિટનની સંસદે પસાર કરેલા ગવર્નર્ન્સટ ઓફ ઇન્ડિયા એકટ, 1935 અનુસાર ચાલતું હતું.

### ભારતની બંધારણ સમિતિ

બંધારણ સમિતિની પ્રથમ બેઠક 9 ડિસેમ્બર, 1946ના રોજ મળી હતી. તેમાં ડેનિનેટ મિશન પ્લાનમાં સૂચય્યાં મુજબ પ્રાંતીય ધારાસભાઓના સભ્યો દ્વારા પરોક્ષ રીતે ચૂંટાયેલા 389 સભ્યોની પસંદગી કરવામાં આવી હતી. 11 ડિસેમ્બર, 1946ના રોજ ડૉ. રાજેન્ડ્ર પ્રસાદને બંધારણ સમિતિના અધ્યક્ષ અને હેરેન્ડ્ર કુમર મુખરજીને તેના ઉપાધ્યક્ષ નિમવામાં આવ્યાં હતાં. 3 જૂન, 1947ના રોજ માઉન્ટબેટન યોજના અનુસાર પાડિસ્તાન માટે અલગ બંધારણ સમિતિનું સર્જન કરવામાં આવ્યું હતું. આ રીતે કેટલાક પ્રાંતોના પ્રતિનિધીઓનો પરિષદના સભ્યપદ તરીકે અંત આવ્યો હતો.



## બંધારણ સમાના સત્રો

પ્રથમ સત્ર:	સાતમુંસત્ર:
9–23 ડિસેમ્બર, 1946	4 નવેમ્બર, 1948 –
<b>બીજું સત્ર:</b>	8 જાન્યુઆરી, 1949
20–25 જાન્યુઆરી, 1947	<b>આઠમુંસત્ર:</b> 16 મે – 16 જૂન, 1949
<b>ત્રીજું સત્ર:</b> 28 એપ્રિલ – 2 મે, 1947	<b>નવમુંસત્ર:</b> 30 જુલાઈ – 18 સપ્ટેમ્બર, 1949
<b>ચોથું સત્ર:</b> 14–31 જુલાઈ, 1947	<b>દસમુંસત્ર:</b> 6–17 ઓક્ટોબર, 1949
<b>પાંચમુંસત્ર:</b> 14–30 ઓગસ્ટ, 1947	<b>અંગ્રીયાસુંસત્ર:</b> 14–26 નવેમ્બર, 1949
<b>છફું સત્ર:</b> 27 જાન્યુઆરી, 1948	

## બંધારણ સમાના મહિલાઓ

ભારતના બંધારણની રચના તેવા સમય કરવામાં આવી હતી જ્યારે વિશ્વના અનેક ભાગોમાં મહિલાઓને મૂળભૂત અધિકારોથી વંચિત રાખવામાં આવતી હતી. બંધારણ સભામાં કુલ 15 મહિલાઓએ સ્થાન મેળવ્યું હતું, જેમાં સરોજની નાયકુ, રાજકુમારી અમૃત કૌર, હંસાબહેન જીવરાજ મહેતા, સુચેતના કિપલાની અને જી. દુર્ગાબાઈનો સમાવેશ થાય છે.

તેના પરિણામે સમિતિની સભ્યસંખ્યા ઘટીને 299 થઈ ગઈ હતી. ભારતનું બંધારણ 26 જાન્યુઆરી, 1950ના રોજ અમલમાં આવ્યું હતું. આ દિવસે સમિતિનું અસ્તિત્વ સમાસ થયું હતું અને 1952માં જ્યાં સુધી નવી સંસદ રચાઈ નઈ ત્યાં સુધી તેણે પોતાને ભારતની કામચલાઉ સંસદમાં પરિવર્તિત કરી હતી.

### વિશ્વના સૌથી લાંબા બંધારણનું નિર્માણ

બંધારણ સમિતિની પ્રથમ બેઠક નવી દિલ્હીમાં સંસદ ગૃહના સેન્ટ્રલ હોલમાં 9 ડિસેમ્બર, 1946ના રોજ મળી હતી.

સ્વતંત્ર ભારતનું બંધારણ ઘડવાના ઐતિહાસિક કાર્યને પૂર્ણ કરવા માટે બંધારણ સમિતિએ બે વર્ષ, અંગ્રીય મહિના અને સતત દિવસ એટલે કે લગભગ ત્રણ વર્ષ જેટલો સમય લીધો હતો. આ સમયગાળા દરમિયાન, તેણે કુલ 165 દિવસોને આવરી લેતાં

વિશ્વના સૌથી લાંબું બંધારણ વિશ્વના તમામ સાર્વભૌમ દેશોમાં સૌથી લાંબું બંધારણ છે. તેના વર્તમાન સ્વરૂપમાં તેમાં આમુખ, 22 ભાગો સાથે 395 અનુચ્છેદો, 12 અનુસૂચીઓ, ચાર પરિશિષ્ટો અને 104 સુધારાઓનો સમાવેશ થાય છે.

“

“સ્વતંત્રતા બાદ જ્યારે કરોડો લોકો નવી આશા સાથે આગળ વધવાનું સ્વપ્ન સેવતાં હતા અને તે સમયે પ્રવર્તમાન વિપરિત સંજોગોમાં પણ તેમનો જૂસ્સો આસમાને હતો, તેવા સમયે તમામને સ્વીકાર્ય બને તેવું બંધારણ આપવાનું કાર્ય સરળ નહોતું.”

”

26 નવેમ્બર,  
2017ના રોજ  
પ્રધાનમંત્રીએ  
કહેલી વાત

અંગ્રીય સત્રોનું આયોજન કર્યું હતું. 13 ડિસેમ્બર, 1946ના રોજ પંડિત જવાહરલાલ નહેરાએ ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ કર્યો હતો જેને 22 જાન્યુઆરી, 1947ના રોજ સર્વાનુમતે સ્વીકારી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ 14 ઓગસ્ટ, 1947ની રાત્રીએ બંધારણ ખંડમાં બેઠક હોજાઈ હતી અને બરાબર બારના ટકોરે સ્વતંત્ર ભારતની ધારાસભાએ કામગીરી સંભાળી હતી.

29 ઓગસ્ટ, 1947ના રોજ ભારતના બંધારણનો મુસદ્દો તૈયાર કરવા માટે ડૉ. બી.આર. અંબેડકરની અદ્યક્ષતા હેઠળ બંધારણ સભાએ ડ્રાફ્ટિંગ સમિતિની રચના કરી હતી. 4 જાન્યુઆરી, 1948ના રોજ તેનો પ્રથમ મુસદ્દો તૈયાર થયો હતો. બંધારણના મુસદ્દા ઉપર ચર્ચા-વિચારણા કરતી વખતે સભાએ તેની સમક્ષ રજૂ કરાયેલા 7,635માંથી લગભગ 2,473 જેટલા સુધારાઓની ચર્ચા કરી હતી અને તેનો નિકાલ કર્યો હતો.



પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2010માં, 26 નવેમ્બરના રોજ જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતાં ત્યારે હાથી ઉપર બંધારણની નકલ મૂકીને શોભા ચાત્રા કાઢી હતી. સમગ્ર ચાત્રા દરમિયાન તેઓ પોર્ટ હાથીની આગળ-આગળ ચાલ્યાં હતાં.

ભારતનું બંધારણ 26 નવેમ્બર, 1949ના રોજ અપનાવવામાં આવ્યું હતું અને 24 જાન્યુઆરી, 1950ના રોજ તેના સત્યોએ તેની ઉપર હસ્તાક્ષર કર્યા હતાં. આમ, બંધારણ ઉપર કુલ 284 સત્યોના હસ્તાક્ષર જોવા મળે છે.

**હસ્તલિખિત દસ્તાવેજ:** ભારતના બંધારણની પ્રથમ નકલ હાથથી લખવામાં આવી હતી. સુલેખક પ્રેમ બિહારી નારાયણ રાયજાદાએ ઈટાલિક શૈલી અંગ્રેજી આવૃત્તિ, જ્યારે વસ્તંત છિણા વૈદે તેની હિંદી પ્રત તૈયાર કરી હતી. પશ્ચિમ બંગાળમાં શાંતિનિકેતનના કલા ભવનમાંથી કલાકાર નંદલાલ બોડ અને તેમની ટીમ છારા તેનું સુશોભન કાર્ય કરવામાં આવ્યું છે. ભારતના બંધારણની મૂળ હિંદી તથા અંગ્રેજી નકલોને ભારતના સંસદના પુસ્તકાલયમાં હિલિયમ ભેરેલા વિશિષ્ટ રીતે બનાવેલા કબાટમાં રાખવામાં આવી છે. હસ્તલિખિત દસ્તાવેજ ઉપરથી, દહેરાદૂનના હાથીબારકલા વિસ્તારમાં સ્થિત ભારતીય સર્વેક્ષણના ઉત્તર પ્રિન્ટિંગ જૂથમાં લિથોગ્રાફી પ્રિન્ટિંગનો ઉપયોગ કરીને 1,000 નકલો પ્રિન્ટ કરવામાં

## નાગરિકો, પ્રશાસકોએ બંધારણની ભાવના અનુસાર જ કામગીરી કરવી જોઈએ

પ્રધાનમંત્રીએ 26 નવેમ્બર, 2017ના રોજ મન કી બાત કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, દરેક નાગરિકોની ફરજ છે કે તેઓ બંધારણની જોગવાઈઓનું અક્ષરશ: પાલન કરે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, "નાગરિકો અને પ્રશાસકોએ સાથે મળીને સમાન રીતે આપણાં બંધારણની ભાવના અનુસાર પોતાની કામગીરી હાથ ધરવી જોઈએ. આપણાં બંધારણનો સાર એટલો જ છે કે કોઈપણ વ્યક્તિને કોઈપણ રીતે હાનિ ન પહોંચવી જોઈએ. બંધારણ દિવસ નિમિતે બાબાસાહેબ આંબેડકરનું સ્મરણ સ્વાભાવિક છે."

તે જ દિવસે બીજા એક કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે, "સમયની માંગ છે કે આપણે બધા એક-બીજાને સશક્ત બનાવીએ. એક સંસ્થા અન્યની જરૂરિયાતો સમજવા માટે અને તેમના છારા જે પડકારોનો સામનો કરાય છે તે સમજવા માટે સક્ષમ હોવા જોઈએ. જ્યારે આ ત્રણ સંસ્થાઓ (કારોબારી, જ્યાયતંત્ર અને ધારાસભા) બંધારણમાં નિર્દિષ્ટ તેમની ફરજો ઉપર દ્યાન કેન્દ્રિત કરશે ત્યારે જ તેઓ દેશના નાગરિકોને અધિકારપૂર્વક કંઈક કહી શકવા સક્ષમ બનશે. કૃપા કરીને તમારી ફરજોનું પાલન કરો અને 'મારે શું ચિંતા'ની માનસિકતા ત્યજુને સમાજ અને દેશનો વિચાર કરો."

આવી હતી. પ્રિન્ટ થયેલી પ્રથમ નકલ ઉત્તરીય પ્રિન્ટિંગ પ્રભાગના કબાટમાં સલામત રીતે સાચવવામાં આવી છે.

26 જાન્યુઆરીએ બંધારણ શા માટે અપનાવવામાં આવ્યું

31 ડિસેમ્બર, 1929ના રોજ કોંગ્રેસે પૂર્ણ સ્વરાજનો પ્રસ્તાવ પસાર કર્યો હતો અને લોકોને દર વર્ષ 26મી જાન્યુઆરીનો દિવસ સ્વતંત્રતા દિન તરીકે ઉજવવાનું આહાન કર્યું હતું. સ્વતંત્રતા પછી, તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે બંધારણનો અમલ 26 જાન્યુઆરી, 1950ના રોજ થશે.

**ભારતે 2019માં બંધારણની સ્વીકૃતિની 70મી જન્મજયંતિ ઉજવી**

સંસદ ગૃહના સેનટર હોલ ખાતે ભારતના બંધારણની સ્વીકૃતિની 70મી જન્મજયંતિ ઉજવવામાં આવી હતી. આ તે જ સ્થાન છે જ્યાં 1949માં બંધારણ અપનાવવામાં આવ્યું હતું. બંધારણ દિવસના રોજ સવારે 11 વાગે બંધારણની પ્રસ્તાવનાનું સામૂહિક વાંચન કરાયું હતું. ■



“ આપણે સૌ ભારતીયો માટે એ જરૂરી બની જશે કે મુસ્લિમો, પ્રિસ્ટીઓ, ચહુદીઓ, પારસીઓ અને અન્ય તે તમામ લોકો જે જેમના માટે ભારત માતૃભૂમિ છે તેઓ રાષ્ટ્રધવજને અપનાવે જેના માટે જીવવા અને મરવા પણ તૈયાર હોય. ”

— મહાત્મા ગાંધી

## ભારતનો તિરંગો રાષ્ટ્રની આન, બાન અને શાન

દ્વારા શાનો રાષ્ટ્રધવજ માત્ર તેની ઓળખનો જ એક ભાગ નથી પરંતુ તેની સ્વતંત્રતાનું પ્રતિક પણ છે. ભારત માટે, રાષ્ટ્રધવજ લોકોની આશા, પ્રેમ અને તાકાતનું પણ પ્રતિક છે. તિરંગા તરીકે પણ ઓળખાતો (ત્રણ રંગો હોવાના કારણે) ભારતનો રાષ્ટ્રધવજ સત્ય અને શાંતિનો પણ સંકેત રજૂ કરે છે.

ભારત બંધારણ દિવસની ઉજવણી કરી રહ્યું હોવાથી તેના રાષ્ટ્રધવજની સફર ઉપર એક નજીર કરવી વધુ મહત્વપૂર્ણ બની જાય છે. બ્રિટિશ છુકુમત સામે ભારતની સ્વતંત્રતાની લડાઈમાં મહત્વપૂર્ણ હથિયાર તરીકે દવજનો ઉપયોગ કરાયો હતો.

ભારતના રાષ્ટ્રધવજને તેના વર્તમાન સ્વરૂપમાં બંધારણ સભામાં 22 જુલાઈ, ૧૯૪૭ના રોજ અપનાવવામાં આવ્યો હતો. ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭થી રૂ જાન્યુઆરી, ૧૯૫૦ની વરચે તેણે ભારતીય સંસ્થાનના રાષ્ટ્રધવજ તરીકે સેવા આપી હતી અને ત્યારબાદ પ્રજાસત્તાક ભારતના રાષ્ટ્રધવજ તરીકે. ભારતનો રાષ્ટ્રધવજ ભારતના લોકોની આશા અને આકાંક્ષાઓનું પ્રતિબિંબ રજૂ કરે છે. તે રાષ્ટ્રના ગૌરવની નિશાની છે. છેદ્ધા સાત દાયકાઓ દરમ્ભિયાન રાષ્ટ્રધવજની આન, બાન, શાન જાળવવા માટે સશસ્ત્ર દળો સહિત અનેક લોકોએ નિઃસંકોચપણે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધા છે.



### ભારતનો રાષ્ટ્રધવજ

- ભારતનો રાષ્ટ્રધવજ આડો તિરંગો છે, જેમાં કેસરી રંગ સૌથી ઉપર, સફેદ રંગ મદ્યમાં અને લીલો રંગ સૌથી નીચે એક સરખું કદ ધરાવે છે. કેસરી રંગ તાકાત અને શૌર્યનું પ્રતિક છે, સફેદ રંગ શાંતિ અને સત્ય જ્યારે લીલો રંગ સમૃદ્ધિ, વિકાસ અને શુભતાનું પ્રતિક છે.
- દવજની પહોળાઈ સાથે તેની લંબાઈનો ગુણોત્તર 2:3 છે.

થક



## રાષ્ટ્રદ્વજ કાયદો



- સફેદ પહુંચાના મધ્યમાં ધર્મ ચક તરીકે ઓળખાતું વાદળી રંગનું 24 દાંતા ધરાવતું ચક છે. આ ચકને અશોક સ્તંભમાંથી લેવામાં આવ્યું છે, "ધર્મ ચક" દેશની પ્રગતિનું પ્રતિક દર્શાવે છે. તેનો વ્યાસ અંદાજે સફેદ પહુંચ જેટલો છે.

- 26મી જાન્યુઆરી, 2002ના રોજ ભારતીય રાષ્ટ્રદ્વજ કાયદામાં સ્વતંત્રતાના આશરે 55 વર્ષ બાદ સુધારો કરવામાં આવ્યો હતો અને ભારતના લોકો દરરોજ પોતાના ધરે, કચેરીએ અને ફેકટરી પર રાષ્ટ્રદ્વજ ફરકાવી શકે તે માટે મંજૂરી આપવામાં આવી હતી. અગાઉ માત્ર રાષ્ટ્રીય પર્વ વખતે જ તેઓ રાષ્ટ્રદ્વજ ફરકાવી શકતાં હતાં. હવે ભારતીયો રાષ્ટ્રદ્વજ સંબંધિત કાયદાકીય જોગવાઈઓનું ચુસ્તતાથી પાલન કરવામાં આવે તે રીતે, કોઈપણ સ્થાને અને કોઈપણ સમયે ગૌરવપૂર્વક રાષ્ટ્રદ્વજ ફરકાવી શકે છે, જેથી રાષ્ટ્રદ્વજની અવમાનનાનો કોઈ પ્રશ્ન ઊભો ન થાય. સુગમતા માટે ભારતીય રાષ્ટ્રદ્વજ કાયદો, 2002 ત્રણ ભાગોમાં વિભાજિત કરવામાં આવ્યો છે: કાયદાના ભાગ-1 માં રાષ્ટ્રદ્વજના સામાન્ય વર્ણનનો સમાવેશ કરવામાં આવ્યો છે, ભાગ-2 નાગરિકો, ખાનગી સંગઠનો, શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા રાષ્ટ્રદ્વજ ફરકાવવા સંબંધિત જોગવાઈ કરે છે અને ભાગ-3માં કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા અને તેમના સંગઠનો અને સંસ્થાઓ દ્વારા પ્રદર્શન સંબંધિત બાબતો દર્શાવે છે.

## તિરંગાનો ઉદ્ભબ

ભારતીય રાષ્ટ્રદ્વજ સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન પોતાના ઉદ્ભવથી અત્યાર સુધી અનેક ફેરફારોમાંથી પસાર થયો છે. રાષ્ટ્રદ્વજના ઉદ્ભવમાં કેટલાક નોંધપાત્ર ઐતિહાસિક સીમાચિંહો આ પ્રમાણે છે:

- ભારતમાં સૌ પ્રથમ વખત રાષ્ટ્રદ્વજ 7 ઓગસ્ટ, 1906ના રોજ કોલકાતામાં પારસી બાગાન (ગ્રીન પાર્ક) ખાતે ફરકાવવામાં આવ્યો હોવાનું કહેવામાં આવે છે. આ દવજમાં લાલ, પીળી અને લીલી એમ ત્રણ આડી પહૂંચીઓનો દર્શાવવામાં આવી હતી.**
- બીજો દવજ 1907માં પારસી મહિલા મેડમ કામા અને તેમના કાંતિકારી સહ્યોના સમૂહ દ્વારા ફરકાવવામાં આવ્યો હતો. આ દવજ પ્રથમ દવજ જેવો જ હતો. આ દવજને બર્લિનમાં સમાજવાદી પરિષદમાં પણ લહેરાવવામાં આવ્યો હતો.**
- ત્રીજી વખત દવજ 1917માં ફરકાવવામાં આવ્યો હતો જ્યારે રાજકીય અંદોલન તેના નિર્ણયક તબક્કામાં હતું. એની બેસન્ટ અને લોકમાન્ય તિલકે હોમરૂલ અંદોલન વખતે તેને ફરકાવ્યો હતો. આ દવજ પાંચ લાલ અને ચાર લીલી વારાફરતી ગોઠવેલી આડી પહૂંચીઓ ધરાવતો હતો અને સમાજિક સમૂહમાં સાત તારાઓ તેની ઉપર દર્શાવવામાં આવ્યાં હતાં. ડાબી બાજુના ઉપરના ખુણા પર ચુનિયન જેક મુકવામાં આવ્યો હતો. એક ખુણામાં સફેદ અર્ધચંદ્ર અને તારો પણ હતો.**
- અંધના બેઝવાડા (અત્યારે વિજયવાડા) ખાતે અભિલ ભારતીય કોંગ્રેસ સમિતિના 1921ના અધિવેશન દરમિયાન પિંગાલી વેકેચાએ એક દવજ તૈયાર કરીને તેને ગાંધીજી સમક્ષ રજૂ કર્યો હતો. તે બે રંગો, લાલ અને લીલામાંથી બનાવવામાં આવ્યો હતો, જે બે મુખ્ય સમુદ્ધાર્યો હિંદુ અને મુસ્લિમનું પ્રતિનિધિત્વ કરતાં હતાં. 1931માં આ દવજને અપનાવવામાં આવ્યો હતો. આ દવજ ભારતીય રાષ્ટ્રીય સૈન્યના ચુંદુક પ્રતિક પણ હતો.**
- 1931નું વર્ષ દવજના ઈતિહાસમાં ખૂબ જ મહિંદ્રપૂર્ણ રહ્યું છે. તિરંગાને આપણાં રાષ્ટ્રદ્વજ તરીકે અપનાવવાનો પ્રસ્તાવ પસાર કરાયો હતો. આ દવજ વર્તમાન દવજનું પ્રતિબિંબ હતો, જેમાં કેસરી, સંક્રાંતિ, સંપ્રદાયિક મહિંદ્રપૂર્ણ રહ્યું છે. માત્ર કેન્દ્રમાં ચરખાના સ્થાને સંબ્રાંત અશોકના ધર્મચક્ષુણ સ્થાન આપવામાં આવ્યું છે.**
- 22 જુલાઈ, 1942ના રોજ બંધારણ સભાએ સ્વતંત્ર ભારતના રાષ્ટ્રદ્વજ તરીકે તેને અપનાવ્યો હતો. સ્વતંત્રતા બાદ, દવજના રંગો અને તેનું મહિંદ્રપૂર્ણ સમાન જ રહ્યું છે. માત્ર કેન્દ્રમાં ચરખાના સ્થાને સંબ્રાંત અશોકના ધર્મચક્ષુણ સ્થાન આપવામાં આવ્યું છે.**

સ્લોગન: <https://knowindia.gov.in>

# સફળ વ્યૂહનીતિના પરિણામો આવ્યા

**સાજા થયેલા દર્દીઓનો આંકડો 75 લાખ કરતાં વધારે થયો**

હોસ્પિટલમાં ભરતી થયેલા કેસોની અસરકારક તબીબી સારવાર માટે કેન્દ્ર, રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના સામુહિક પ્રયત્નોના ખૂબ જ સકારાત્મક પરિણામો જોવા મળી રહ્યાં છે, જેના પરિણામે ભારતમાં કોવિડ-19 મૃત્યુદરમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. તે માર્ય મહિના પછી હવે 1.49 ટકાના સૌથી નિચા દરને ઉપર્થી ગયો છે. અસરકારક નિયંત્રણ રણનીતિ, આકમક પરીક્ષણ અને સમગ્ર સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં સારવારના સર્વગ્રાહી માપદંડના આધારે તબીબી વ્યવસ્થાપનના કારણે નવા નોંધાતાં મૃત્યુની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો આવ્યો છે. 26 ઓક્ટોબરના રોજ, ભારતમાં 500થી પણ ઓછા મૃત્યુ (497) નોંધાયાં હતાં.

કોવિડ-19 વ્યવસ્થાપન અને પ્રતિભાવ નીતિના ભાગઢાપે કેન્દ્ર સરકાર માત્ર કોવિડ-19ના નિયંત્રણ ઉપર જ નહીં પરંતુ મૃત્યુની સંખ્યા ઘટાડવામાં અને કોવિડના જટિલ અને ગંભીર દર્દીઓને ગુણવત્તાયુક્ત તબીબી સારવાર પૂરી પાડીને તેમના જીવન બચાવવા ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

## ઉપરાધ્રૂપતિ અને તેમના પતની

આશરે એક મહિલાના આઈસોલેશન બાદ ઉપરાધ્રૂપતિ એમ.વેદેયા નાયકું અને તેમના પતની ઉધા નાયકુંનો 26 ઓક્ટોબરના રોજ કોવિડ-19 ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. 29 સપ્ટેમ્બર, 2020ના રોજ કોવિડ-19નું નિદાન થયા પછી તેઓ હોમ-કવોરેન્ટાઇન હેઠળ હતાં. ■

**જ્યાં સુધી દવા નહીં, ત્યાં સુધી થીલાશ નહીં**



**91.68 %**

રિકવરી દર



અત્યાર સુધી થયેલા  
કુલ પરીક્ષણો  
**11,07,43,103**



લેબોરેટરી – સરકારી -1132|ખાનગી -905  
સાજા થયેલા દર્દીઓ **75,44,798**

સક્રિય કેસો

**5,61,908**

કુલ દર્દીઓ

**81,06,706**

કુલ દર્દીની વસ્તીની સરખામણીમાં ઓક્ટોબરમાં ચેપ અને મૃત્યુના દરમાં ઘટાડો જોવા મળ્યો છે. ઓક્ટોબરમાં, ચેપની સંખ્યામાં 71.61%નો ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે મૃત્યુની સંખ્યામાં 70.57% ઘટાડો નોંધાયો હતો.

( 1 નવેમ્બર સુધીના આંકડાઓ; સ્નોત: આરોગ્ય મંત્રાલય )

## આયુષ મંત્રાલય ક્રારા કામગીરીની સમીક્ષા હાથ ધરાઈ

આયુષ મંત્રાલયના સચિવ વૈધ રાજેશ કોટેચાએ ઉચ્ચ-સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં તાજેતરના મહિનાઓમાં મંત્રાલયે કરેલી વિવિધ અસરકારક કામગીરીઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું અને તેનું કોવિડ-19 નિવારણ અને સંચાલનમાં નોંધપાત્ર યોગદાન જોવા મળ્યું હતું. અગ્ર સચિવો અને આયુષ મંત્રાલય અને વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સચિવોએ વીડિયો કોન્ફરન્સ ક્રારા આ બેઠકમાં ભાગ લીધો હતો. કોટેચાએ કોવિડ-19 નિયમન માટે તાજેતરમાં બહાર પાડેલા રાષ્ટ્રીય આર્થુરેન અને યોગ શિષ્ટાચારની પ્રશંસા કરી હતી. આ ઉપરાંત તેમણે રાષ્ટ્રીય આયુષ મિશન (NAM) અંતર્ગત મંજૂર કરાયેલા આયુષ આરોગ્ય સુખાકારી કેન્દ્રોની ઝડપથી કાર્યનિવિત કરવા અને NAM હેઠળ રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ સ્તરે ખર્ચ અને ભંડોળના પ્રવાહમાં સુધારો કરવાની તાત્કાલિક જરૂરિયાત પણ વ્યક્ત કરી હતી.



# તાજી હવામાં શ્વાસ લેવાની ખોજ

વાયુ પ્રદૂષણ માત્ર માનવો, પશુ-પક્ષીઓ અને વૃક્ષોને જ નુકસાન પહોચાડી રહ્યું નથી પરંતુ પદ્ધતિઓ, જમીન, ઈમારતો વગેરે જેવા પદાર્થોને પણ દૂષિત બનાવે છે. 1996માં સર્વોચ્ચ અદાલતે આપેલા એક ચૂકાદામાં ઈમારતોના આરોગ્ય ઉપર વાયુ પ્રદૂષણની થતી હાનિકારક અસરોની મહત્વપૂર્ણ બાબતો આવરી લેવામાં આવી હતી. વાયુ પ્રદૂષણ ઉપર નિયંત્રણ મેળવવા માટે સરકાર કેન્દ્રિક, સામૂહિક અને સંગઠિત કાર્યો હાથ ધરીને કાર્યક્રમ આગળ વધારી રહી છે.

**વિ**શ્વ આરોગ્ય સંગઠન (WHO)ના એક અહેવાલ અનુસાર સમગ્ર વિશ્વમાં દર વર્ષે વાયુ પ્રદૂષણના કારણે 38 લાખથી પણ વધારે લોકોના મૃત્યુ નીપજે છે. વિશ્વમાં 90 ટકાથી પણ વધારે બાળકોને પ્રદૂષિત હવામાં શાસ લેવાની ફરજ પડે છે. સમગ્ર વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોમાં ભારતના 14 સૌથી વધુ પ્રદૂષિત શહેરો સ્થાન ધરાવે છે. દિવાળી અને શિયાળાની શરૂઆતના સમયગાળામાં ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં ધૂમાડાનું જાડું આવરણ છવાઈ જાય છે. કોવિડ-19 મહામારીને દ્યાનમાં રાખતાં ચાલુ વર્ષે વાયુ પ્રદૂષણના જોખમે વધારે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. જોકે, આ તમામ નકારાત્મકતાઓની વરચ્ચે કેટલાક ખુશીના સમાચાર પણ છે. વાયુ પ્રદૂષણના નિરાકરણ માટે કોઈ જાહુર છઠી નથી તે વાત અવાર-નવાર ભારપૂર્વક કહેવાતી હોવા છતાં સરકારે વાયુ પ્રદૂષણ સામે લડવા માટે અનેક પગલાંઓ

“

ભારત પ્રદૂષણ પ્રત્યે માત્ર સજાગ જ નહીં પરંતુ તેના ઉપાયો શોધવાના પ્રયત્નોમાં સક્રીય રીતે જોડાયેલું છે. તે સ્વરચ્છ ભારત અભિયાન હોય, ધૂમાડા-રહિત રંધાણ ગેસ હોય, LED ઝૂંબેશ હોય, CNG આધારિત પરિવહન અથવા ઇલેક્ટ્રિક યાતાયાત હોય, આપણે પ્રદૂષણના ઉકેલ માટે કોઈ કચાશ બાકી રાખતાં નથી. અમે પેટ્રોલના કારણે સર્જાતા પ્રદૂષણને ઘટાડવા માટે ઇથેનોલના વપરાશ ઉપર ભાર મૂકી રહ્યાં છે... અમે લોક ભાગીદારીથી સંકલિત અભિગમ અને આધુનિક ટેકનોલોજી થકી પસંદ કરાયેલા 100 શહેરોમાં પ્રદૂષણ ઘટાડવા માટે સર્વગ્રાહી અભિગમ ઉપર કામગીરી કરી રહ્યાં છે.

- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી



પ્રધાનમંત્રીએ પંજાબના ખેડૂતોની પ્રશંસા કરી

ઓક્ટોબર, 2018માં પોતાના મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પંજાબના ખેડૂત ગુરબચન સિંઘની પ્રશંસા કરી હતી. પોતાના પુત્રના લખ નક્કી કરતે વખતે ગુરબચન સિંઘે પુત્રવધુના પરિવારને અપીલ કરી હતી કે તે તેમને વચ્ચન આપે કે તે તેમના ખેતરોમાં પરાળ (પાક



“

2016માં 'સારી' હવાના દિવસોની સંખ્યા 106 હતી જેની સરખામણીએ 2020માં આ આંકડો વધીને 218 ઉપર પહોંચી ગયો છે અને 1 જાન્યુઆરીથી 30 સપ્ટેમ્બર 2016 દરમિયાન 'ખરાબ' ગુણવત્તાની હવા ધરાવતાં 156 દિવસોની સંખ્યા ઘટીને 56 ઉપર પહોંચી ગઈ છે.

”



18 ઓક્ટોબર, 2020ના રોજ ફેસબુક લાઇંગ કાર્યક્રમમાં પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રીએ જણાવેલી વાત.

## વાહનના પ્રદૂષણ ઉપર નિયંત્રણ

- સરકાર પેટ્રોલ સાથે ઇથેનોલના ભિશ્રણને પ્રોત્સાહન આપી રહી છે. સરકારે 2022 સુધી 10 ટકા ઇથેનોલ અને 2030 સુધી 20 ટકા ઇથેનોલના ભિશ્રણનો લક્ષ્ય નિર્ધારિત કર્યો છે.
- ભારત સ્ટાન્ડર્ડ IV પછી, સરકારે 1 એપ્રિલ, 2020થી ભારત સ્ટાન્ડર્ડ VI ઉપર છલાંગ લગાવી છે. તેના કારણે વાહનોના પ્રદૂષણમાં 70 ટકા સુધીનો ઘટાડો થશે.

## પુસ્તા શુદ્ધમજૂવીય વિઘટક કેપ્સ્યુલ

ભારતીય કૃષિ સંશોધન સંસ્થા નવી ઇન્હીએ કચરો બાળવાની સમસ્યા ઉકેલવા માટે સુશુદ્ધમજૂવીય વિઘટક કેપ્સ્યુલ બનાવી છે. દરેક રૂપિયા 5ની ડિમ્બત ધરાવતી આવી કેપ્સ્યુલ માટે 25 લીટર ક્રાવણાની જરૂર રહે છે, જેનો ઉપયોગ એક હેક્ટાર ખેતરમાં પાકના બાકી બચેલા કચરાનું ઝડપી વિઘટન કરવા માટે ઉપયોગ કરી શકાય છે.

લાણા પછી વધેલા તુંઠા) બાળશે નહીં. તેમણે મૂકેલી આ શરત સમાજની સાચી તાકાતનું પ્રતિબિંબ રજૂ કરે છે.

આ જ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ પંજાબમાં નાભા નજીક આવેલા ગામ કાલર માજરાની પણ પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે અહીં ખેડૂતો પરાળ બાળવાના બદલે તેમના ખેતરને ખેડીને માટી સાથે કચરો ભેગો કરે છે અને તેની પ્રક્રિયા માટે તેમણે જરૂરી ટેકનોલોજી પણ સ્વીકારી છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે જે લોકો પર્યાવરણને સ્વરચ્છ અને પ્રદૂષણ મુક્ત રાખવા માટે પોતાના શ્રેષ્ઠ પ્રયત્નો કરી રહ્યાં છે તેઓ સાચા વારસદાર તરીકે તંદુરસ્ત જીવનશૈલીની ભારતીય પરંપરા આગળ વધારી રહ્યાં છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, "જેવી રીતે નાના નાના ટીપાંથી સાગરનું સર્જન થાય છે તેવી જ રીતે નાના-નાના સામૂહિક પ્રયત્નો સકારાત્મક માહોલના સર્જનમાં મહિંપૂર્ણ ભૂમિકા ભજવે છે."

## AQI દર્શાવવા ભોભાઇલ અેપ



**સમીર:** ઓક્ટોબર, 2017માં શરૂ કરવામાં આવેલી સમીર લોકોને હવાની ગુણવત્તા અંગેની માહિતી પૂરી પાડે છે. તે હવાને પ્રદૂષિત કરતી પ્રવૃત્તિઓ સામે ફરિયાદ નોંધાવવાની જોગવાઈ ધરાવે છે. હવાની ગુણવત્તા સંબંધિત માહિતીનું એકત્રિકરણ અને પ્રસારણ કેન્દ્રિકૃત સ્થાન પરથી કરવામાં આવે છે. તે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પ્રકાશિત થતાં રાષ્ટ્રીય હવા ગુણવત્તા સૂચકાંક (AQI)ની કલાક દીઠ માહિતીની જાળકારી સિવાય તમામ હિતધારકોને વાસ્તવિક-સમય હવાની ગુણવત્તા અંગેની માહિતી પૂરી પાડે છે.



**SAFAR:** 'વાયુની ગુણવત્તા' અને હવામાનના અનુમાન સંશોધન પ્રણાલી (S A F A R )' એ એકીકૃત વહેલા ચેતવણીની પ્રણાલી છે જેની શરૂઆત 72 કલાક અગાઉથી જ હવાની ગુણવત્તા અને હવામાનનું અનુમાન કરવા માટે થઈ છે. SAFAR દિલ્હી, પૂણે, મુંબઈ અને અમદાવાદ એમ ચાર શહેરમાં કાર્યાન્વિત છે.

## હવાની ગુણવત્તા ખૂદારવા માટે કામગીરીની રૂપરેખા

- સમગ્ર દેશમાં વાયુ પ્રદૂષણની સમસ્યા ઉકેલવા માટે કેન્દ્ર સરકારે લાંબા-ગાળાની, સમય-મર્યાદિત, રાષ્ટ્રીય-સ્તરની રેણીતિ તરીકે રાષ્ટ્રીય સ્વરચ્છ હવા કાર્યક્રમ શરૂ કર્યો છે. તેનો હેતુ 2017ના વર્ષને આધાર વર્ષ રાખીને વર્ષ 2024 સુધી PM 10 અને PM 2.5ના સર્કેન્દ્રણમાં 20-30 ટકાના ઘટાડાનો લક્ષ્ય હંસલ કરવાનો છે.
- 2011-2015 અને W H O અહેવાલ 2014/2018ના સમયગાળા માટે વ્યાપક હવા ગુણવત્તાની માહિતીના આધાર તરીકે મોટાભાગે ગંગાના મેદાની વિસ્તારોમાં એકસો બે બિન-પ્રાસિ શહેરોની ઓળખ કરવામાં આવી છે. જમીની સ્તરે અમલીકરણ માટે આ તમામ શહેરો માટે શહેર-આધારિત કાર્યયોજનાને મંજૂરી આપવામાં આવી છે.
- NCRમાં હવાના પ્રદૂષણના નિવારણા, નિયંત્રણ અને શમન માટે ઓળખી કાઢવામાં આવેલા કાર્યો માટે સમયમર્યાદાઓ અને અમલીકરણ સંસ્થાઓની નિર્દિષ્ટ કરીને 2018માં સર્વગ્રાહી કાર્યયોજના અધિસૂચિત કરી છે.
- NCRમાં હવાના પ્રદૂષણના નિવારણા, નિયંત્રણ અને ઉપશમન માટે 12 જાન્યુઆરી, 2017ના રોજ વર્ગીકૃત પ્રતિક્રિયા કાર્યયોજના અધિસૂચિત કરવામાં આવી છે. તે મુખ્યત્વે નબળી, ખૂબ જ નબળી, ગંભીર અને ગંભીર+ અથવા આપાતકાલીન શ્રેણીઓમાં ચાર AQIની પ્રતિક્રિયા માટે વર્ગીકૃત પગલાંઓ અને અમલીકરણ સંસ્થાઓની ઓળખ કરે છે.

## કૃષિ કચરો બાળવાની સ્વભાવ્યાના ઉકેલ માટે પગલાં

- સરકારે કૃષિ કચરાના વ્યવસ્થાપન માટે રાજ્યોને 3. 1,700 કરોડની ફાળવણી કરી છે. વર્તમાન સમયમાં, કૃષિ કચરાનું દણન ટકાવવા માટે મશીનરી માટે સરકાર સહકારી સસ્થાઓને 80 ટકા સબસિડી અને વ્યક્તિઓને 50 ટકાની સબસિડી પૂરી પાડે છે.
- ઉત્તરપ્રદેશ, હરિયાણા અને રાજ્યસ્થાનમાં કેટલાક કેન્દ્રબિંદુ ઓળખી કાઢવામાં આવ્યાં છે અને રાજ્ય સરકારોને તેની ઉપર વધુ દ્યાન કેન્દ્રિત કરવા નિર્દેશો આપવામાં આવ્યાં છે.
- રાજ્યની કાર્ય યોજનાઓ તૈયાર કરવામાં આવી છે તથા તેની ચર્ચા-વિચારણા કરાઈ છે, જેનો ટૂંક સમયમાં અમલ કરવામાં આવશે.

ભર્યા છે અને તમામ હિતધારકો એટલે કે કેન્દ્ર, રાજ્ય સરકારો અને નાગરિકોએ આ બીમારી સામે લડવા એકજૂથ થઈને કામ કરવાની જરૂર છે.

ઉત્તરીય રાજ્યો ખાસ કરીને દિલ્હીમાં શિયાળા દરમિયાન વાયુ પ્રદૂષણની સમસ્યાઓમાં માનવસર્જિત કારણો ઉપરાંત હવામાન અને ભૌગોલિક પરિબળોના કારણે અનેકગણો વધારો થતો જોવા મળે છે. 29 સપ્ટેમ્બર, 2020ના રોજ પર્યાવરણ, વન અને જળવાયુ

પરિવર્તન મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે, "વાયુ પ્રદૂષણનો સામનો કરવા માટે કોઈ જાદુઈ છડી નથી. તેના માટે હવામાન અને ભૌગોલિક પરિબળો જવાબદાર છે, જે દર વર્ષ 2-3 મહિનાઓ દરમિયાન માનવસર્જિત પરિબળોના કારણે વધુ ઉત્ત્ર સ્વરૂપ ધારણ કરે છે. કેન્દ્ર, દિલ્હી સરકાર, પડોશી રાજ્યો અને નાગરિકોએ ભેગા મળીને કામ કરવાની જરૂરિયાત છે. તે આપણાં સૌની જવાબદારી છે." ■

# 2022 સુધીમાં ઘરવિહોણા પ્રત્યેક પરિવારોને ભણશે પોતાનું ઘર

રોટી અને કપડાં પછી પોતાનું ઘર વસાવવું એ દરેક વ્યક્તિનું હંમેશાા એક સપનું હોય છે. જોકે, શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં મોટી સંખ્યામાં ભારતીયો પોતાના માથા ઉપર છતથી વંચિત રહેવા પામ્યાં છે. ઘરવિહોણા લોકોની પરિસ્થિતિમાં સુધારો કરવા માટે, સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના  
(PMAY)નો પ્રારંભ કર્યો છે



**એ** રનું ઘર દરેક વ્યક્તિની પાચાની જરૂરિયાતો પૈકીની એક જરૂરિયાત છે. પરંતુ બાળકોનું શિક્ષણ, પરિવારનું આરોગ્ય અને અન્ય રોજિંદી જરૂરિયાતોના પરિણામે સમાજના નિમ્ન વર્ગમંથી આવતાં અનેક લોકો માટે પોતાનું ઘર વસાવવું સપનું અધુરું જ રહી જાય છે. અત્યાર સુધી શરૂ કરવામાં આવેલી તમામ સરકારી યોજનાઓ વિવિધ કારણોસર પોતાના હેતુ સાર્થક કરવામાં નિષ્ફળ રહી છે, જેમાંથી પારદર્શિતાનો અભાવ એક મુખ્ય કારણ હતું. 2015માં શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજના

ઘર એટલે તેવું સ્થાન, જ્યાં શિષ્ટ જીવન તરફ દોરી જતી તમામ સુવિધાઓ ઉપલબ્ધ હોય છે, તેવું સ્થાન છે, જ્યાં પરિવારની ખુશીઓ હોય અને ઘરના દરેક સહ્યો પોતાના સપનાં સાકાર કરી શકે. પ્રધાનમંત્રી આવાસ યોજનાનું આ મુખ્ય હાર્ડટ્રપ તત્વ છે. આપણે જ્યારે દેશનો 75મો સ્વતંત્રતા દિન ઉજવી રહ્યાં છીએ ત્યારે અમે દરેક ગરીબ વ્યક્તિને તેનું/તેણીનું પોતાનું ઘર આપવાનું સ્વપ્ન ધરાવીએ છીએ.

પ્રધાનમંત્રી, નરેણ્ઝ મોઈ



# પ્રધાનમંત્રી આવાસ યોજના – ગ્રામીણ

લક્ષ્યાંક  
**2,26,98,288**

નોંધણી  
**1,84,75,380**

મંજૂરી  
**1,71,00,848**

પૂર્ણ  
**1,18,21,595**

નાણાં હસ્તાંતરણ  
**રૂ. 1,65,861 કરોડ**

લાભાર્થીઓની સામાજિક-આર્થિક અને જાતિ ગણતરી (SECC) અને ગ્રામસભા દ્વારા પ્રમાણિત માપદંડોનો ઉપયોગ કરીને પસંદગી કરવામાં આવે છે. PMAY-ગ્રામીણ યોજનાને સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ (SBMG) જેવી અન્ય કેન્દ્ર સરકારની યોજનાઓ સાથે જોડવામાં આવી છે, જેના દ્વારા મનરેણા અને અન્ય યોજનાઓ સાથે સહકારમાં શૌચાલયના નિર્માણ માટે રૂ. 12,000 સુધીની સહાયતા પૂરી પાડવામાં આવે છે.

## PMAY-G ભૂટે પાત્રતા માપદંડો

- એવા પરિવારો જે પોતાનું ઘર ધરાવતાં નથી અથવા તેવા ધરના માલિક છે જે મહત્વમાં કાચી દિવાલ અને છાપરાં ધરાવતાં બે ઓરડાં ધરાવે છે.
- 25થી વધુ ઉંમર ધરાવતાં સાક્ષર વચ્ચે સભ્ય ધરાવતાં ન હોય તેવા કુટુંબો
- 16થી 59 વર્ષની વચ્ચે ઉંમર ધરાવતાં વચ્ચે સભ્યો ધરાવતાં હોય તે સિવાયના કુટુંબો
- દિવ્યાંગ સભ્યો ધરાવતાં પરિવારો અને સક્ષમ શરીર ન ધરાવતાં પરિવારના સભ્યો
- રોજિંદી મંજૂરી કરીને આવક મેળવતા જમીનવિહોણા લોકો
- અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) અને લઘુમતી સમુદાય



- આવાસોના બાંધકામનો ખર્ચ કેન્દ્ર અને રાજ્ય સરકારોની વચ્ચે 60:40ના ગુણોત્તરમાં વહેંચવામાં આવે છે, મેદાની વિસ્તારોમાં દરેક માટે રૂ. 1.20 લાખ સુધીની સહાયતા આપવામાં આવે છે.
- હિમાલયના પર્વતીય રાજ્યો, પૂર્વોત્તર રાજ્યો અને જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશમાં ગ્રામીણ વિસ્તારો માટે ગુણોત્તર 90:10 છે, એટલે કે કેન્દ્ર સરકાર 90 ટકા ખર્ચ ઉઠાવશે અને રાજ્ય સરકાર પ્રત્યેક એકમ માટે રૂ. 1.30 લાખ સુધીની 10 ટકા રકમનું ધીરાણ પૂર્ણ પાડશે.
- નવરચિત કેન્દ્રશાસિત પ્રદેશ લદ્ધાખ સહિત કેન્દ્રશાસિત પ્રદેશોમાં આવાસોના બાંધકામ માટે કેન્દ્ર સરકાર દ્વારા 100 ટકા ધીરાણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

સંપૂર્ણ પારદર્શિતા સાથે વંચિત લોકોને સંભાનજનક જીવન પૂરું પાડવાનો હેતુ ધરાવે છે. છેલ્લા છ વર્ષોમાં સરકારે સમગ્ર દેશમાં 2.25 કરોડ ધરવિહોણા લોકોને પોતાના ધરનો કબજો સૌંઘ્યો છે.

આ યોજના ગ્રામીણ અને શહેરી વસાહતો માટે અલગ-અલગ જોગવાઈઓ ધરાવે છે. PMAY (શહેરી) મિશન વર્ષ 2022 સુધી શહેરી વિસ્તારોમાં તમામ લોકોને આવાસ પૂરું પાડવાનું લક્ષ્ય રાખે છે. PMAY (ગ્રામીણ)



# પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)

25 જૂન, 2015ના રોજ શરૂ થયેલી આ યોજના 30 ચોરસ-મીટરનો આવાસ પૂરો પાડે છે

કામગીરીની ઝડપ તે હકીકત ઉપરથી જાળી શકાય છે કે 2022 સુધી PMAY (શહેરી) અંતર્ગત 1.20 કરોડ ઘરોની જરૂરિયાત હતી અને અત્યાર સુધી 1.07 કરોડ ઘરોના બાંધકામને મંજૂરી આપી દેવામાં આવી છે. સરકારની મંજૂરી તથા દેખરેખ સમિતિએ ચાલુ વર્ષે ઓગસ્ટમાં 10 લાખથી વધારે ઘરોને મંજૂરી આપી છે. યોજનામાં કેન્દ્ર સરકારની સહાયતા રૂ. 1.72 લાખ કરોડ છે. અત્યાર સુધી, તેમણે રૂ. 76,753 કરોડ મંજૂર કર્યા છે. યોજનામાં કુલ રોકાણ રૂ. 6.49 લાખ કરોડ છે.

## PMAY-U માટે લાયકાત માપદંડ

- રૂ. 3 લાખ સુધીના વાર્ષિક આવક ધરાવતાં આર્થિક રીતે નબળા વર્ગો (EWS)
- રૂ. 3 લાખથી રૂ. 6 લાખની વરયેની આવક ધરાવતાં નિમન-આવક ધરાવતાં જૂથ (LIG)
- રૂ. 12 લાખથી ઓછી આવક ધરાવતાં મધ્યમ-આવક જૂથ (MIG) અને તેઓ રૂ. 2.35 લાખની કેડિટ લિંક સબસિડી માટે લાયકાત ધરાવે છે
- રૂ. 18 લાખથી ઓછી વાર્ષિક આવક ધરાવતાં મધ્યમ-આવક જૂથ અને તેઓ રૂ. 2.35 લાખની કેડિટ લિંક સબસિડી માટે લાયકાત ધરાવે છે

## ઘરના બાંધકામમાં સહાયતા

પાણી, ગાર્ટર જોડાણ અને શૈચાલય જીવી સુવિધા સાથે ઘરો બાંધવામાં આવે છે. EWS અને LIG સાથે સંબંધ ધરાવતાં લોકો રૂ. 1 લાખથી રૂ. 2.30 લાખ સુધી વ્યાજની સબસિડી પ્રાપ્ત કરશે. પોતાના ઘરનું પુનઃનિર્માણ માટે રૂ. 1.5 લાખ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

## પરવકે તેવા ભાડાના આવાસની યોજના (ARHS)

કેટલીક વખત, એક શહેરમાં પોતાનું મકાન ધરાવતી વ્યક્તિએ વધુ સારા શિક્ષણ અથવા રોજગારીની ખોજમાં અન્ય શહેરોમાં કામચલાઉ સ્થળાંતરકરવાની જરૂર પડે છે. પરવકે તેવા ભાડાની આવાસ સંકુલ PMAY-Uનો ભાગ છે, જે એક અથવા બે રૂમના આવાસો થકી તેમને રાહત પૂરી પાડે છે. આ આવાસો સ્થળાંતરિત મજૂરોને માર્ચ 2022 સુધી ઉપલબ્ધ બની રહેશે. સ્થાનિક બજાર સર્વેક્ષણ અથવા સંચાલકો અથવા સંગ્રહનો ઢ્રારા પોતાની રીતે શહેરી સ્થાનિક સંસ્થાઓ ઢ્રારા ભાડું નક્કી કરવામાં આવશે. બે વર્ષામાં ભાડામાં 8 ટકાનો વધારો-ઘટાડો કરી શકાશે.

## કોને ફાયદો થશે

આ યોજનાના કારણે સ્થળાંતરિત શ્રમિકો, શહેરી ગરીબો, રીક્ષાચાલકો, ફેરિયાઓ, શિક્ષણ અને આરોગ્ય વિભાગમાં કામ કરતાં લોકો અને EWS અને LIG શ્રેણી સાથે સંબંધ ધરાવતાં વિધાર્થીઓને

ફાયદો થશે. કોઈ અન્ય શહેરમાં યોજનાનો લાભ પ્રાપ્ત કરનારા લોકો અન્ય સ્થળાંતર કરે તો તેઓ પણ પાત્રતા ધરાવશે.

## મહિલા સશક્તિકરણ

અગાઉની આવાસ યોજનાઓથી વિપરિત, PMAYમાં EWS અને LIG વર્ગની મહિલાઓના સશક્તિકરણ ઉપર ભાર મૂક્યો છે. આ યોજના હેઠળ પરિવારની મુખ્ય મહિલાને ઘરની માલિક અથવા સહ-માલિક બનાવવી ફરજિયાત કરવામાં આવી છે.

## ભષાચારને અવકાશ નહીં

- લાભાર્થીઓ પસંદ કરવાની, ઘરોનું બાંધકામ અને ઘરનો કબજો સોપવાની સમગ્રે પ્રક્રિયા પારદર્શિયો છે.
- બાંધકામ કામગીરી ઉપર ચુસ્ત દેખરેખ રાખવામાં આવે છે. બાંધકામ કામગીરીની પ્રગતિ થાય તેમ તેમ ભંડોળ પૂરું પાડવામાં આવે છે.

ડિજિટલ પ્લેટફોર્મ:

**PMAY-G:** [www.payg.nic.in](http://www.payg.nic.in)

**PMAY-U:** [www.pmaymiss.gov.in](http://www.pmaymiss.gov.in)

પણ ગ્રામીણ વિસ્તારોમાં આ જ પ્રકારનો હેતુ ધરાવે છે. આ યોજનાનો વ્યાપ માત્ર ગરીબો, જરૂરિયાતમંદો અને પણ વર્ગના લોકો પૂરતો જ મર્યાદિત નથી, પરંતુ તેમાં મધ્યમ વર્ગના લોકોનો પણ સમાવેશ થાય છે.

સરકારે ડિજિટલ પ્રમાણીકરણની મદદ ઢ્રારા PMAYને પારદર્શિયો બનાવી છે. 2011ની વસ્તી ગણતરીને ગ્રામીણ વિસ્તારોમાં પાકા ઘરો માટે લાભાર્થીઓની પસંદગી કરવા માટેનો આધાર બનાવવામાં આવી છે. ■

# નવા ભારત માટે આવિજ્ઞારની નવી ઓફિન



માનવતાનો ઇતિહાસ વાસ્તવિક રીતે આવિજ્ઞારનો ઇતિહાસ છે અને કદાચ તેની શરૂઆત પૈડાંની શોધ સાથે થાય છે. પુરાતન સમયથી વર્તમાન ડિજિટલ ચુગ સુધી સમગ્ર વિશ્વમાં આવિજ્ઞારે માનવ જીવનમાં આમૂલ પરિવર્તન આપ્યું છે. ભારતે પણ આ સમૃદ્ધ ગાથામાં નોંધપાત્ર ભૂમિકા ભજવી છે અને અવિરતપણે તેની સામાજિક સમસ્યાઓ નિવારવા નવીન માર્ગો શોધ ચાલુ રાખી છે. અર્થતંત્ર અને વિકાસ માટે આ ચાર પરિબળો અત્યંત મહિંપૂર્ણ છે – વિજ્ઞાન અને ટેકનોલોજી, નાગરિક સમાજ, ઉદ્ઘોગ અને સરકાર. આવિજ્ઞાર સાથે, ભારત આ પરિબળોને માત્ર એક-બીજા સાથે પરસ્પર જોડતું જ નથી પરંતુ એક નવી સફળ ગાથા પણ લખી રહ્યું છે. ભારત 2024–25 સુધી 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનવાની કલ્પના સેવે છે. આ લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા માટે 2016માં અટલ ઇનોવેશન મિશન (AIM) શરૂ કરવામાં આવ્યું હતું.





## સ્ટોરી-1

**રૂમા** દિત્ય રાજ્યપુત અમદાવાદમાં ધોરણા 10માં અભ્યાસ કરી રહ્યો હતો. તેના એક શિક્ષકનો એક ડ્રિચકી વાહન ચાલક સાથે અકસ્માત થયો, જે લાઈસન્સ ધરાવતો નહોતો. આદિત્યએ તેના મિત્રો વિમલ મહેશ્વરી, લેખ પટેલ અને માધિશ પરિખની સાથે મળીને લોકોને લાઈસન્સ વગર વાહન ચલાવતાં અટકાવવા માટેનો માર્ગ શોધવાનું નક્કી કર્યું. તેમણે એક સ્માર્ટ લોક વિકસાવ્યું. આ પ્રતિકૃતિ માલિકને કાર્યરત ડ્રાઇવિંગ લાઈસન્સ વાપરવાનું સૂચન આપે છે. આ સિસ્ટમને વપરાશકર્તાના ફોનમાં એપ્લિકેશન સાથે પણ જોડી શકાશે અને જો તેને શરૂ કરવા અનધિકૃત લાઈસન્સનો ઉપયોગ કરાશે તો માલિકને તે અંગે ચેતવયામાં આવશે.

## સ્ટોરી-2

**રૂમા** મગ્રા વિશ્વમાં હૃદયરોગનો હુમલો માનવના મૃત્યુનું મુખ્ય કારણ છે. હૃદયરોગના હુમલાના કારણે મોટાભાગના મૃત્યુ એટલા માટે થાય છે કારણ કે તેમને સમયસર તબીબી સહાયતા ઉપલબ્ધ બની શકતી નથી. અમદાવાદના મહિનગરમાં બેસ્ટ હાઇર્સ્ક્યુલના બે વિદ્યાર્થીઓ વિમલ અને રોહિતે પહેરી શકાય તેવી ઘડિયાળ જેવી બેન્ડ વિકસાવી છે, જે ECGમાં વિવિધ ફેરફારોનો અભ્યાસ કરી શકે છે અને હૃદયરોગના હુમલાના 30 મિનિટ પહેલાં ચેતવણી આપી શકે છે. તે સ્વયંસંચાલિત રીતે નજીકની હોસ્પિટલ અને દર્દીના સંબંધીઓને ચેતવણી આપવા ઉપરાંત જીવન રક્ષક દવાઓ પણ શરીરમાં મુક્ત કરી શકે છે.

**રૂમા** વા માનસ હંમેશા જિજ્ઞાસાઓથી છલકાતું હોય છે અને આવિજ્ઞાનની અનંત સંભાવનાઓ ધરાવે છે. જોકે 2016 સુધી, યોગ્ય મંચના અભાવે બાળકો દ્વારા હાથ ધરાતાં આવિજ્ઞાની વાત ભાગ્યેજ સાંભળવા મળતી હતી. ચુવા મનોની ક્ષમતાનો વિચાર કરીને સરકારે જિજ્ઞાસુ મનને માત્ર યોગ્ય મંચ પૂરો પાડવા જ નહીં પરંતુ પોતાની આગવી વિચારસરણી ઊભી કરવા તેમજ અન્ય વિદ્યાર્થીઓને પણ પ્રેરણા પૂરી પાડવા અટલ ઈનોવેશન મિશન (AIM) શરૂ કર્યું છે. હવે આ પ્રયત્નોના મીઠાં ફળ ચાખવા મળી રહ્યાં છે કારણ કે ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્શન, 2020માં ભારતનો ક્રમ સુધરીને 48માં સ્થાને પહોંચી ગયો છે, જે AIMની જવલંત સફળતા દર્શાવે છે. 2015માં, ભારતને આ જ સૂચકાંકમાં 81મું સ્થાન પ્રાપ્ત થયું હતું.

# ભારત: વિકાસનું નવું એન્જિન

આ મુદ્દાઓ સમજો, આવિષ્કાર અને ઉદ્ઘોગસાહસિકતામાં વૃદ્ધિ કરીને વિજ્ઞાનને આવિષ્કાર સાથે સાંકળતી કરીનું સર્જન કરવાનો અભિગમ શું છે, જેથી વિકાસ માટે આવશ્યક પાચાડુપ ચાર સ્તર્ભો એકસાથે આગળ વધારી શકે અને નવા ભારતનું સ્વપ્ન સાકાર કરી શકે.

## અટલ ટિકાર્ડિંગ લેબ

શાળાના સ્તરે આવિષ્કાર

લક્ષ્યાંક

10,000 શાળાઓમાં

સ્થાપના

5400, બાકીની માર્ચ, 2021 સુધી



31. 20

લાખ પ્રતિ સ્કૂલ દીઠ  
મદદ આપવામાં આવે છે

- ભારતમાં 'નવા આવિષ્કારકર્તાઓ' તરીકે દસ લાખ બાળકોને ઉછેર કરવાના ઉદ્દેશ સાથે, AIM દ્વારા સમગ્ર ભારતમાં શાળાઓમાં અટલ ટિકાર્ડિંગ લેબોરેટરી (ATLs) સ્થાપવામાં આવી છે.
- તેનો ઉદ્દેશ ચુવા મનમાં જિજ્ઞાસા, સર્જનાત્મકતા અને કલ્પનાનું સિંચન કરવાનો અને સર્જનાત્મક ચિંતન, ગણતરીપૂર્વકની વિચારસરણી, અનુઝૂલનશીલ શિક્ષણ, ફિઝિકલ કમ્પ્યુટિંગ વગેરે જેવા કૌશલ્યોને પ્રેરિત કરવાનો છે.
- ATL તેવું કાર્ય સ્થાન પ્રદાન કરે છે જ્યાં ચુવા મન પોતાના અનુભવના આધારે પોતે વિકસાવેલા તેમના વિચારોને આકાર આપી શકે છે અને નવીન કૌશલ્ય શીખી શકે છે. તે હેઠળ, ધોરણ ની 10ના વિદ્યાર્થીઓને STEM (વિજ્ઞાન, ટેકનોલોજી, એજિઝિનિયરિંગ અને ગણીત)ના ખ્યાલો સમજવા માટે સાધનો અને ઉપકરણો સાથે કામગીરી કરવાની તક આપવામાં આવે છે.
- AIM ATL માટે દરેક સ્કૂલને રૂ. 20 લાખનું અનુદાન પૂરું પાડે છે.
- તેમાં દરેક ATL માટે રૂ. 10 લાખનો એક વખતનો સ્થાપના ખર્ચ અને મહત્વમાં પાંચ વર્ષના સમયગાળા માટે રૂ. 10 લાખના કાર્યકારી ખર્ચાઓનો પણ સમાવેશ થાય છે.
- જુલાઈ મહિના સુધી, સમગ્ર દેશમાં 660થી પણ વધારે જિલ્લાઓમાં 5, 100થી વધારે ATLની સ્થાપના કરવામાં આવી, જેની પહોંચ 2 મિલિયનથી પણ વધારે વિદ્યાર્થીઓ સુધી જોવા મળ્યો હતો.

નાડું રાજ્યાંત્રિક  
નાડું રાજ્યાંત્રિક

- અભિયાન દ્વારા આ પહેલ દેશમાં સામુદાયિક આવિષ્કાર ઝૂંબેશોને સહાયતા કરવા માટે હાથ ધરવામાં આવી છે.
- આ કાર્યક્રમ સમાજની સેવા કરવાના વિચારને દ્યાનમાં રાખીને ઉપાયલક્ષી રચનાઓ થકી આવિષ્કારની ભાવનાને પ્રોત્સાહન કરવા રચનામાં આવ્યો છે.
- તે દેશના અભ્યવિકસિત/અવિકસિત વિસ્તારો ઉપર દ્યાન કેન્દ્રિત કરશે જ્યાં અત્યારે ગતિમાન સ્ટાર્ટઅપ અને આવિષ્કાર પારિસ્થિતિક તંત્રનો અભાવ જોવા મળે છે.
- પ્રસ્તાવિત લક્ષીત વિસ્તારોમાં ટીઅર-1/મેટ્રો શહેરો, ટીઅર-2 અને ટીઅર-3 શહેરો, સ્માર્ટ શહેરો, આકાંક્ષી જિલ્લાઓ, પુર્વોત્તર, જમ્મુ અને કાશ્મીર તથા ભારતના ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોના અભ્યવિકસિત/અવિકસિત પ્રદેશોનો સમાવેશ થાય છે.
- તે વિશિષ્ટ અને પ્રોત્સાહિત ઉપાયો પૂરા પાડે છે જે વિદ્યાર્થીઓ, સંશોધકો અથવા નવીન ઉપાયોના વિચાર અને રચના માટે વિદ્યાર્થીઓ, સંશોધકો અથવા કોઇ વ્યક્તિઓ/વ્યક્તિઓના જૂથોને પ્રોત્સાહન પૂરું પાડશે.



અટલ ઇનોવેશન મિશન



• સમસ્યા



• વિચાર



• ઉકેલ

અટલ ઇન્ક્યુબેશન સેન્ટર (AIC)  
(ઉદ્ઘોગસાહસિકતા માટે પારિસ્થિતિક તંત્રનું સર્જન)

**101** આસામ કૃષિ યુનિવર્સિટી, બનાસ્થલી યુનિવર્સિટી, BHU અને અન્ય ખાનગી સંસ્થાઓ સ્થાપવામાં આવી



- તે માર્ચ 2021 સુધીમાં 10,000 શાળાઓ સુધી પહોંચવાનો લક્ષ્યાંક ધરાવે છે.
- યુનિવર્સિટી, NGO, SME અને કોપોરેટ ઉદ્ઘોગના સ્તરે, AIM વિશે કક્ષાની AICની સ્થાપના કરી રહ્યું છે જે દેશના દરેક ક્ષેત્ર/રાજ્યમાં ટકાઉ સ્ટાર્ટઅપના સફળ વિકાસને સક્ષમ બનાવશે અને તેને ઉતેજન પૂરું પાડશે.
- AIC ની સ્થાપના વિનિર્માણ, પરિવહન, ઉર્જા, આરોગ્ય, શિક્ષણ, કૃષિ, પાણી અને સ્વચ્છતા વગેરે જેવા ચોક્કસ વિસ્તારોમાં વિશે સ્તરીય સંવર્ધન સુવિધાઓના સર્જન માટે કરવામાં આવી છે.
- AIM AICની સ્થાપના માટે મૂડી અને કાર્યકારી ખર્ચ આવરી લેવા માટે મહત્વમાં 5 વર્ષના સમયગાળા માટે રૂ. 10 કરોડ સુધીનું અનુદાન પૂરું પાડશે.
- અરજદારે AICની વિશિષ્ટ ઉપયોગ માટે વપરાશ માટે તૈયાર ઓછામાં ઓછી 10,000 ચોરસ કૂટની જગ્યા પૂરી પાડવી પાડશે.
- AIM દ્વારા મહિલા સંચાલિત સંવર્ધન કેન્દ્રો અને ઉદ્યમિતા સ્ટાર્ટઅપને ખૂબ જ પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે. અત્યાર સુધી AIM દ્વારા 68 સંવર્ધન કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે.



## AIM શું છે?

અટલ ઇનોવેશન મિશન (AIM) દેશમાં આવિજ્ઞારની સંસ્કૃતિ અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા સરકારની પ્રમુખ પહેલ છે. નીતિ આચ્યોગ ઝારા સ્થાપવામાં આવેલા AIMનો ઉદ્દેશ અર્થતંત્રના જુદા-જુદા ક્ષેત્રોમાં આવિજ્ઞારને ઉતેજન આપવા માટે નવા કાર્યક્રમો અને નીતિઓ વિકસાવવાનો, તેમને મંચ પ્રદાન કરવાનો અને જુદા-જુદા હિતધારકો માટે તકોનું સંકલન કરવાનો, જાગૃતિનું સર્જન કરવાનો અને દેશમાં આવિજ્ઞાર સંબંધિત પારિસ્થિતિક તંત્ર ઉપર દેખરેખ રાખવા સંવર્ધન માળખાનું સર્જન કરવાનો છે.

## AIM પાછળનો વિચાર

ભૂતપૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગીય લાલ બહાદુર શાસ્ત્રીએ આપણાને જ્ય જ્વાન, જ્ય ડિસાનનું સૂત્ર આપ્યું હતું.

► **લાયકાત ધરાવતાં અરજદારો:** U G C અને AICTE-સંલભ યુનિવર્સિટી, કોલેજ, દેશમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની જાગૃતિ અને પ્રોત્સાહનમાં સારો અનુભવ અને ગણતા ધરાવતાં સ્વૈરિછક અને અન્ય સંગઠનો, ITI અને અન્ય ટેકનિકલ ડિપ્લોમા કોલેજ જેવી શૈક્ષણિક સંસ્થાઓ

► **ભંડોળની વ્યવસ્થા:** કેન્દ્રોની સ્થાપના PPP મોડ અથવા PSU અને અન્ય સંસ્થાઓની સહાયતાથી કરવામાં આવશે. AIM તરફથી મહત્વમાં અનુદાન 3.2.5 કરોડ રહેશે.

ત્યારબાદ, ભૂતપૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીએ તેમાં જ્ય વિજ્ઞાનનું સૂત્ર ઉમેર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક કદમ આગળ વધીને તેમાં જ્ય અનુસંધાનનું સૂત્ર ઉમેર્યું હતું. આ માત્ર એક સૂત્ર નથી પરંતુ સરકારનો નવીન દાઢિકોણ છે.

AIM સંવર્ધન આવિજ્ઞાર સંસ્થાની પરિકલ્પના સેવે છે, જે ઉચ્ચ માધ્યમિક શાળાઓ, વિજ્ઞાન, એન્જિનિયરિંગ અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ અને SME/MSME ઉદ્યોગ, કોપોરેટ અને NGO જેવા વિવિધ સ્તરોએ આવિજ્ઞાર અને ઉદ્યોગસાહસિકતાના પારિસ્થિતિક તંત્રની સ્થાપના અને પ્રોત્સાહનને પ્રેરિત

## અટલ ન્યૂ ઇન્ડિયા યેલેજ (ANIC)



- AIM નો એક પ્રાથમિક ઉદ્દેશ ભારતના વિકાસ માટે અતિ આવશ્યક વિસ્તારોમાં આવિજ્ઞારને વેગવાન બનાવવાનો છે.
- આરોગ્ય, આવાસ, સ્વરચ્છતા, ઉર્જ અને પાણી જેવા વિસ્તારોમાં નવીન ઉપાયો સમાજના તમામ વર્ગોની જીવનધોરણ ઉપર સીધો પ્રભાવ પડી શકે છે.
- કેન્દ્ર સરકારના પાંચ જુદા-જુદા મંત્રાલયો અને વિભાગો સાથે ભાગીદારીમાં કુલ 24 ચેલેજ શરૂ કરવામાં આવ્યા છે.
- આ પહેલ અંતર્ગત, ૭ મહિનામાં આવિજ્ઞારને બજારમાં રજૂ કરવું પડે છે.

રૂ.  
**50**  
લાખ

સંશોધન માટે મંજૂર કરાયા,  
જે ૧ થી ૧.૫ વર્ષોમાં ચૂકવવામાં આવશે



### પરિવર્તનના ભાર્ગદર્શકો | (કૌશલ્ય માટે વિશ્વ સ્તરીય તાલીમ)

- આ કાર્યક્રમ હજારો અટલ ટિકરિંગ લેબ અને સ્ટાર્ટઅપ તથા AIMના કાર્યક્રમ અંતર્ગત સંવર્ધન કેન્દ્રોને માર્ગદર્શન અને દિશા/પૂરી પાડી શકે તેવા આગેવાનોને જોડવા માટે વ્યૂહાત્મક રાજ્ય-નિર્માણ પહેલ છે.
- લોકો જે દર અઠવાડિયે ૧ થી ૨ કલાક આવી એક અથવા વધારે લેબમાં અથવા સ્ટાર્ટઅપ/સંવર્ધન કેન્દ્રોમાં વિતાવી શકે છે અને અનુભવ, અભ્યાસ અને ડિઝાઇન અને ગાણિતિક વિચારસરણી જેવી ભવિષ્યના કૌશલ્યનો અભ્યાસ કરવા સક્ષમ બનાવે છે તથા આવિજ્ઞાર અને ઉદ્યોગસાહસિકતાના પ્રોત્સાહિત કરવા નવી દિશા પૂરી પાડે છે.
- આ લેબોરેટરી બિન-નિર્દેશાત્મક પ્રકારની છે અને માર્ગદર્શકો પોતે પ્રશિક્ષકના બદલે સક્ષમકર્તા બને તે અપેક્ષિત છે.



કરતી કેન્દ્ર, રાજ્ય અને ક્ષેત્રીય આવિષ્કાર યોજનાઓની વર્ચ્યો આવિષ્કાર નીતિઓને સરેરખિત કરવામાં ચાવીથુપ ભૂમિકા ભજવે છે.

### AIMનો ઉદ્દેશ

AIM ના લાંબા-ગાળાના ઉદ્દેશોમાં SME/MSME/સ્ટાર્ટઅપ માટે રાષ્ટ્રીય સ્ટરે લઘુ વેપાર આવિષ્કાર સંશોધન (SBIR) અને વિકાસની સ્થાપના અને પ્રોત્સાહન આપવાનો તથા CSIR (વૈજ્ઞાનિક ઔદ્યોગિક અનુસંધાન પરિષદ), ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ (ICAR) અને ભારતીય તબીબી અનુસંધાન પરિષદ (ICMR) જેવી દેશની અગ્રણી સંશોધન સંસ્થાઓમાં રાષ્ટ્રીય સામાજિક-આર્થિક જરૂરિયાતો સાથે એકરૂપતા સાધવા માટે વિજ્ઞાન અને ટેકનોલોજી આવિષ્કારોને પુનર્જીવિત કરવાનો સમાવેશ થાય છે.

આત્મનિર્ભર ભારત ARISE-અટલ ન્યૂ ઇન્ડિયા ચેલેન્જ (ANIC): ભારતીય MSME અને સ્ટાર્ટઅપમાં પ્રાયોગિક સંશોધન અને આવિષ્કારને ઉતેજન આપવા માટે સપ્ટેમ્બર, 2020માં નીતિ આયોગ ક્રારા આત્મનિર્ભર ભારત ARISE-અટલ ન્યૂ ઇન્ડિયા ચેલેન્જ (ANIC)નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ રાષ્ટ્રીય પહેલ સંશોધન અને આવિષ્કારને પ્રોત્સાહન આપવાનો અને ભારતીય સ્ટાર્ટઅપ અને MSMEની સ્પર્ધાત્મકતા વધારવાનો હેતુ ધરાવે છે.

**અટલ સામુદ્દાયિક આવિષ્કાર કેન્દ્ર:** ટીઅર-2 અને ટીઅર-3 શહેરો સહિત દેશના અલ્પવિકસિત/અવિકસિત વિસ્તારોમાં સમુદ્દાય કેન્દ્રિત આવિષ્કાર અને વિચારોને પ્રોત્સાહિત કરવા

માનવીય વર્તન હુંમેશા બદલાતું રહે છે. તે સમયની સાથે બદલાય છે અને તેને અનુરૂપ બને છે. જો આવિષ્કારો થંભી જાય તો, જીવન થંભી જાય. પ્રણાલીઓ નિર્જવ થઈ જાય અને જ્યારે પ્રણાલીઓ નિર્જવ થઈ જાય ત્યારે જીવન જ્યારે જીવની રહી શકે નહીં. આથી, આવિષ્કાર એ દરેક સમાજ અને દરેક યુગની જરૂરિયાત છે. આપણે આવિષ્કારના માહોલનું સર્જન કરવાની જરૂર છે.

”

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

આત્મનિર્ભર ભારત ARISE-ANIC કાર્યક્રમનો ઉદ્દેશ નવીન ઉત્પાદો અને ઉપાયોને સ્થિર પ્રવાહ પૂરો પાડવાનો છે, જ્યાં કેન્દ્ર સરકારના મંત્રાલયો અને વિભાગો સંભવિત પ્રથમ ખરીદકર્તાઓ બનશે. આ કાર્યક્રમ ક્ષેત્રીય સમસ્યાઓના નવીન ઉપાયો પૂરો પાડવા ભારતીય અવકાશ સંશોધન સંગરન (ISRO), ચાર મંત્રાલયો – સંરક્ષણ મંત્રાલય, ખાદ્ય પ્રસંગકરણ ઉદ્યોગ મંત્રાલય, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય અને તેની સાથે સંલગ્ન ઉદ્યોગો ક્રારા સંચાલિત કરવામાં આવી રહ્યો છે. આત્મનિર્ભર ભારત ARISE-ANIC કાર્યક્રમ ભારતીય MSME ક્ષેત્રની વૃદ્ધિને ગતિ પૂરી પાડવા 'મેક ઇન ઇન્ડિયા', 'સ્ટાર્ટઅપ ઇન્ડિયા', 'આત્મનિર્ભર ભારત'ની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પહેલ સાથે અનુરૂપ છે.

### AIM-SIRIUS ઇનોવેશન ફેસ્ટિવલ

ભારત અને રશિયાના વિદ્યાર્થીઓની વર્ચ્યો આવિષ્કાર ક્ષેત્રે સહકારને પ્રોત્સાહન આપવા માટે ભારતના અટલ ઇનોવેશન મિશન (AIM) અને રશિયન ફેફદ્રેશનના SIRIUS શૈક્ષણિક સંગરન વર્ચ્યો 2018માં સમજૂતી કરારો ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યાં હતાં. AIM-SIRIUS ઇનોવેશન ફેસ્ટિવલનું આયોજન અટલ ઇંડિયા લેબ અને SIRIUS એજયુકેશન ફાઉન્ડેશનના યુવા આવિષ્કર્તાઓમાં સહકારી આવિષ્કારની ભાવનાને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવી રહ્યું છે.

# 2030 સુધીમાં નવીન અને ઉધ્મી ભારત

કેન્દ્ર સરકાર વર્ષ 2030 સુધી ભારતને ઉચ્ચ કોશાલ્યાયુક્ત, નવીન અને ઉધ્મી દેશ બનાવવાનો હેતુ ધરાવે છે. તેના માટે માર્ય 2021 સુધીમાં 10,000 શાળાઓમાં અટલ ટિકારિંગ લેબ સ્થાપવાનું લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યું છે. તેમાંથી અત્યાર સુધીમાં 5,400થી વધુ શાળાઓમાં આ વિશિષ્ટ લેબ સ્થાપવામાં આવી છે. તેના માટે કેન્દ્ર સરકાર છારા 3.20 લાખ ફાળવવામાં આવ્યાં છે. તેની સફળતા તે હકીકત પરથી જ જાણી શકાય છે કે આજે 20 લાખથી વધારે વિદ્યાર્થીઓ આ લેબોરેટરીની ઉપલબ્ધતા ધરાવે છે, જ્યારે આશરે અઢી લાખ બાળકોએ તેના થકી કોઈક આવિષ્કાર કર્યો છે અથવા પ્રતિકૃતિ બનાવી છે.

## ATL ક્ષમુદ્ધાય દિવસ



## અનબોક્સ ટિકારિંગ



## ટિકાર ફેસ્ટ



## ટિકારિંગ મેરાથોન



ડો. બી. આર. અંબેડકરની જન્મજયંતિ ઉજવવા માટે 14 એપ્રિલ તેવી શાળાઓમાં ઉજવવામાં આવે છે જ્યાં અટલ ટિકારિંગ લેબ ઉપલબ્ધ નથી. ATLના છાર નજીકળી બિન-ATL શાળાઓ, NGO અને સ્થાનિક સમુદાયો માટે ટિકારિંગ અને આવિષ્કાર ઉપર મુક્ત સત્ર હાથ ધરીને ટિકાર અને નવીન શોધ કરવા ખોલવામાં આવે છે.

તે ATL માટે શિક્ષક પ્રશિક્ષણ કાર્યક્રમ છે. પસંદ કરાયેલા શાળાના શિક્ષકોને ATLની વિચારધારા અને અધ્યતન ટેકનોલોજી સાધનો અંગે તાલીમ આપવામાં આવે છે. અત્યાર સુધી 50,000થી વધુ શાળાઓમાં આવી ચૂકી છે.

તે ધોરણ 1 થી 12ના શાળાના વિદ્યાર્થીઓ માટે સર્જનાત્મકતા અને આવિષ્કારનો તહેવાર છે. તે બે દિવસીય કાર્યક્રમ છે જ્યાં વિદ્યાર્થીઓ રૂપર્ધા, પ્રદર્શન, વર્કશોપ અને નામાંકિત વક્તાઓ સાથે વાતચીતમાં ભાગ લે છે.

તે 2022 સુધી નવા ભારતના સર્જનના રાષ્ટ્રીય એજન્ડા સાથે એકરૂપ થતી સમસ્યાઓની ઓળખ અને નવીન ઉપાયો વિકસાવવા ઉપર દ્યાન કેન્દ્રિત કરે છે. તે સમગ્ર દેશની ATL શાળાઓ માટે ખૂબી છે, જે આવિષ્કાર્તા કેન્દ્ર બનવામાં શાળાની સફ્ફળતા માટે પરિવર્તન અને યોગદાનની આકાંક્ષા ધરાવે છે.

2018: AIM-SIRIUS ઇનોવેશન ફેરિટવલમાં દસ રશિયન વિદ્યાર્થી આવિષ્કાર્તાઓ અને શ્રેષ્ઠ કામગીરી કરતી અટલ ટિકારિંગ લેબ્સ (ATLs)માંથી દસ ભારતીય આવિષ્કાર્તાઓએ ઓક્ટોબરમાં IIT-દિલ્હીમાં ડિપાર્ટમેન્ટ ઓફ ડિક્ઝાઇન ખાતે ચાર દિવસીય રહેવાસી આવિષ્કાર શિબિરમાં ભાગ લીધો હતો. પાંચ જુદા-જુદા લક્ષ્ય વિસ્તારો – અવકાશ, ટેકનોલોજી, આરોગ્ય સંભાળ, સ્માર્ટ પરિવહન, સ્વરચ્છ ઉર્જા અને કૃષિ ટેકનોલોજીમાં વિવિધ પડકારોને ઉકેલવા માટે પાંચ ટીમોએ પ્રધાનમંત્રી નેરેન્ડ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ પ્લાદિમિર પુટિનને પોતાના સંશોધન પ્રદર્શિત કર્યા હતાં.


2019: સાત દિવસીય સંશોધન આધારિત કાર્યક્રમ માટે રશિયાના સોચીમાં આવેલા સિરિયસ કેન્દ્રની ભારતના 25 વિદ્યાર્થી અને 5 શિક્ષકોના પ્રતિનિધિમંડળ અને રશિયાના 25 વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી હતી. આ ટીમે ડિસેમ્બર 2019માં લક્ષ્ય ક્ષેત્ર રિમોટ અર્થ સેન્સિંગ, બાયોલોજિકલ અને જિનેટિક રિસર્ચ, સ્વરચ્છ સેન્સિંગ, બાયોલોજિકલ અને જિનેટિક રિસર્ચ, સ્વરચ્છ

ઉર્જા, ડેટા એનાલિટિક્સ અને ફન્ડિયર ટેકનોલોજી તથા ફોન અને રોબોટિક્સમાં આઠ જુદા-જુદા આવિષ્કારોનું સર્જન કર્યું હતું.

2020: ભારતના આત્મનિર્ભર ભારત અને રશિયાના બિગ ચેલેન્જસમાંથી પ્રેરણા લઈને AIM અને સિરિયસ છારા સ્ફૂલના વિદ્યાર્થીઓ માટે વિશ્વના સૌ પ્રથમ ઈન્ડો-રશિયન ડ્રિપક્ષીય ચુવા આવિષ્કાર કાર્યક્રમની રૂચના કરવામાં આવી હતી. 7 અને 21 નવેમ્બર વરચ્ચે યોજાયેલા બે સમાહના સહકાર કાર્યક્રમ દરમિયાન 48 વિદ્યાર્થીઓ, 16 શિક્ષણાવિદો અને માર્ગદર્શકોએ આઠ વર્ચ્યુઅલ પ્રોડક્ટ્સ અને મોબાઇલ એપ્લિકેશનની રૂચના કરી હતી જે કોવિડ પછીના સમયગાળાના નવા વૈશ્વિક પડકારોનો ઉકેલ પૂરો પાડશે. ચાલુ વર્ષના સમૂહની પસંદગી સિરિયસ કેન્દ્રમાંથી શ્રેષ્ઠ રશિયન વિદ્યાર્થીઓના જૂથ અને ATL મેરાથોન 2019ની ટોચની 150 ટીમોમાંથી શ્રેષ્ઠ ભારતીય વિદ્યાર્થીઓ અને ATL ઇન્દ્રાજીમાંથી કરવામાં આવી છે. ■

# विज्ञान सेतुः विकासने वेगवान बनाववा आविष्कार

आत्मनिर्भर बनवा माटे, भारत विज्ञान थकी कृषि अने MSME सहित अनेक क्षेत्रोने नवीन अने अलग अभिगम प्रदान करवा एक-बीज साथे जोडी २५०० छे.



**अ** विष्कार द्वेष क्षेत्र माटे अत्यंत आवश्यक छे. परंपरागत पञ्चतिओ अपनावतुं भारत ह्ये तेनो अभिगम बदली २५०० छे. वर्तमान सरकार देशने आर्थिक रीते शक्तिशाली बनाववा माटे आविष्कारने प्रोत्साहन आपवानी बाबतने संपूर्ण महत्व आपवानो ख्याल धरावे छे. आम ते शाळाओ अने कोलेजोना विद्यार्थीओमां आविष्कारनी विचारधारा विकसाववाना कार्यक्मोने आकमक रीते आगण धपावी २५०० छे. १६ ओक्टोबर, २०२०ना रोज खाद अने कृषि संगठनना ७५ वर्षनी उज्जवली निमिते आयोजित कार्यक्रममां बोलतां प्रधानमंत्री नरेन्द्र मोदीसे जणाव्यु हुतुं के सारी प्रजातिना बियारणो अनाजना पोषण मूल्यमां सुधारो करे छे. आवा विकासमां विज्ञान महत्वपूर्ण भूमिका निभावे छे.

२०१४मां प्रधानमंत्रीसे भारतीय विज्ञानिकोने कोलेजना शैक्षणिक कार्यमां पोताने सक्षिय रीते जोडवा माटे करेला आहान बाद विज्ञान सेतु कार्यक्रम शारु करायो हुतो. तेनी उपर कामगीरी करतां, राष्ट्रीय रोग-प्रतिरक्षा संस्थाए उपस्नातक कोलेजो साथे पोताने जोडवा माटे विगतवार कार्यक्रमनी रचना करी छे, जेमां दिल्ही युनिवर्सिटीनी अनेक कोलेजो साथे बिनाओपचारिक परामर्शमां अमलीकरणाना सिद्धांतो, व्याप अने पञ्चति अंगे कामगीरी करवामां आवी छे. अत्यार सुधी दस दिल्ही युनिवर्सिटीनी कोलेजो आ कार्यक्रममां भागीदारी करवा माटे संमत थई छे.

उच्च शिक्षणमा शैक्षणिक संशाधनोनी अष्टतने द्यानमां राखीने आ ख्याल २५०० करायो छे. भारत वैविध्यपूर्ण शैक्षणिक क्षेत्रोमां उच्च तज्ज्ञ क्षमता धरावतां हजारो विज्ञानिको साथे सेंकडो राष्ट्रीय संशोधन संस्थाओ धरावे छे. राष्ट्रीय संशोधन संस्थाओ Phd पहेलाना अभ्यासक्रमोमां नहींवत अने उपस्नातक स्तरे सहेज पाणि पञ्चतिसरनी शैक्षणिक कटिबद्धताओ धरावती नथी.

कारकिर्दीना विकल्प तरीके विज्ञान अने टेक्नोलोज्यना क्षेत्रमां प्रवेश करवा तेजस्वी युवा मानसोने वधुने वधु प्रोत्साहित करवाना राष्ट्रीय लक्ष्यांकमां योगदान आपवा

## વધુ પોષણાથુકત ભારતીય થાળી



**પ**ધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખાદ્ય અને કૃષિ સંગઠનના 75 વર્ષની ઉજવણી દરમિયાન ખાદ્ય પોષણના આવિષ્કાર ઉપર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ભારતમાં ઘઉં અને ચોખા સહિત વિવિધ પાકોની 17 નવી પ્રજાતિઓના બિયારણો જેડૂતોને ઉપલબ્ધ બનાવવામાં આવી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, કેટલાક વખત સામાન્ય પ્રજાતિના પાકો કેટલાક પોષકતત્વો અને સુષ્ટમ-પોષકતત્વોની ગેરહાજરી ધરાવે છે. આ પાકોની સુધારેલી પ્રજાતિઓ આ તમામ ખામીઓથી મુક્ત હોય છે અને ઉચ્ચ પોષણ મૂલ્ય ધરાવે છે. છેલ્ખા કેટલાક વર્ષો દરમિયાન આવા બિયારણોના સંશોધન અને વિકાસ માટે દેશમાં નોંધપાત્ર કામગીરી કરવામાં આવી રહી છે.

હવે પ્રોટિન, લોહતત્વ, કિંક વગેરે જેવા પોષક ઘટકોથી સમૃદ્ધ પાકોને દેશમાં પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. રાગી, જુવાર, બાજરી, કોડો, ઝંગોરા, બારી, કોટકી વગેરે જેવા બરછટ ધાનના ઉત્પાદનને વધારવા માટે અને લોકો પોતાના આહારમાં આ ધાનનો સમાવેશ કરે તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ભારતે 2023ને આંતરરાષ્ટ્રીય ધાન વર્ષ જાહેર કરવાનો પ્રસ્તાવ પણ રજૂ કર્યો છે.

માટેઓ કાર્યક્રમ શરૂ કરાયો હતો.

### સંશોધન શા માટે મહિંત્વપૂર્ણ છે

કૃષિ સંશોધનના ક્ષેત્રમાં વિવિધ આવિષ્કારો અને પહેલોએ સમગ્ર વિશ્વ અને ખાસ કરીને ભારતમાં હરિત હાંતિના નવા ચુગનો પ્રારંભ કર્યો હતો. તેના કારણે લાખો લોકોને માત્ર ભૂખમરાના કારણે થતાં મૂલ્યથી જ બચાવી શકાયા નથી પરંતુ અસંખ્ય લોકોને ગરીબીમાંથી બહાર નીકળવામાં પણ મદદ મળી છે. પરંતુ ભૂખમરા ઉપર વિજય અને કુપોષણા નાભૂદ કરવાનો વૈશ્વિક લક્ષ્યાંક હજૂ પણ પૂર્ણ થવાથી દૂર છે. કુપોષણા લગભગ બે

## આત્મનિર્ભર ભારત માટે વિજાન-સમાજ-સેતુ

આત્મનિર્ભર ભારતનો લક્ષ્યાંક પ્રામ કરવા માટે વિજાન અને ટેકનોલોજી (S&T) ઉપાય કેન્દ્રિત હસ્તક્ષેપ આવશ્યક છે, જેમાં ઉપાયોનો અભાવ ધરાવતાં અને વધુ સારા ગુણવત્તાચુક્ત જીવન માટે સ્થાનિક સ્તરે ઉદ્યમિતા અને સેવાઓના વિકાસ અને પ્રોત્સાહનને ઓળખવામાં આવેલા મુદ્દાઓ ઉપર ઉપાયલક્ષી અભિગમ મહિંત્વપૂર્ણ છે. વંચિત રહેલા લોકો સુધી વ્યાપ વધારવાના હેતુ સાથે આત્મનિર્ભર ભારત માટે વિજાન-સમાજ-સેતુ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. સ્થાનિક સ્તરે ટેકનોલોજી, જ્ઞાન, કૌશલ્ય અને સંશાધનોને અસરકારક રીતે સરેજિત કરવા કાર્યક્રમ આત્મનિર્ભર ભારતની 'સામાજિક ઈન્જિનિયરિંગ' અને 'ટેકનોલોજી સંચાલિત વ્યવસ્થા'ને મજબૂત બનાવવાનો હેતુ ધરાવે છે.



કૃષિ અને  
સંલઘ ક્ષેત્ર

સામાજિક  
ઈન્જિનિયરિંગ

MSME અને  
આર્થિક ક્ષેત્ર

બહુ-ક્ષેત્રીય  
વિકસારો

## આત્મનિર્ભર ભારત માટે વિજાન-સમાજ-સેતુનો ઉદ્દેશ

- NGO/CBO અને સમૂદાયોની S&T ક્ષમતામાં વધારો કરવો
- ઉચ્ચ માપદંડ ધરાવતી યોગ્ય અને પરવકે તેવી ટેકનોલોજી પૂરી પાડવા S&T NGO સાથે આવિષ્કાર અને સંલઘતા વધારવા માટે સામાજિક રીતે જરૂરી અને સંબંધિત R&D સાથે જ્ઞાન સંગઠનોને નવી દિશા પૂરી પાડવી
- સ્વદેશી ટેકનોલોજી અને અસરકારક આપૂર્તિ વ્યવસ્થાતંત્ર પ્રત્યે નિર્દેશિત SEED યોજનાઓ વિકસાવવા માટે નવા વિચારો અને ભાગીદારીની ઓળખ કરવી
- ગ્રામીણ પૃષ્ઠભૂમિમાં સામાજિક-આર્થિક પુનઃવૃદ્ધિ માટે પાચાર્યુપ આવિષ્કાર કેન્દ્રો અને કાર્યક્રમ વ્યવસાય મોડલોનું સર્જન કરવું

અબજ લોકોને પ્રભાવિત કરે છે અને બાળકોમાં આશરે 45 ટકા મૃત્યુ માટે જવાબદાર છે. સંયુક્ત રાષ્ટ્રોના ટકાઉ વિકાસ લક્ષ્યાંકોમાં પણ આ મુદ્દાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતે બાળકો, ગર્ભવતી મહિલાઓ અને સ્તરનપાન કરાવતી માતાઓમાં પોષકક્ષમ આહારમાં વધારો કરવા માટે પોષણ અભિયાન શરૂ કર્યું છે.

### પરિવર્તન કેવી રીતે શરૂ થયું

કુપોષણ સામેની ભારતની લડાઈ નાની ઉમરમાં ગર્ભ ધારણા, શિક્ષણ અને જ્ઞાનનો અભાવ, પીવાલાયક પાણી અને સ્વરચ્છતાના અભાવ જેવી સમસ્યાઓનો સામનો કરતી હતી. આ પડકારોની વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં કુપોષણ સામેની લડાઈ શરૂ કરવા ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પોતાના અનુભવનો ઉપયોગ કરીને 2014માં રાષ્ટ્રીય કાર્યક્રમ શરૂ કર્યો હતો. સરકારે 11 કરોડ શૌચાલયોના નિર્માણ, પોષણ ઉપર વિશેષ ભાર, તમામ લોકો માટે નળથી જળ અને 1 રૂપિયામાં સેનેટરી પેડ પૂરાં પાડીને આ દિશામાં ચુંદના ધોરણે કામગીરી શરૂ કરી હતી. હવે, અનાજનું પોષકીય મૂલ્ય સુધારવા માટે સારી વૈવિધ્યપૂર્ણ પાકની પ્રજાતિ – બાયો-ફોટિફાઇઝ પ્રજાતિ ઉપર પણ વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. 2014 પહેલા બાયો-ફોટિફાઇઝ બિયારણોની માત્ર એક જ પ્રજાતિ ખેડૂતો સુધી પહોંચી હતી ત્યારે અત્યારે વિવિધ પાકો માટે 70 બાયો-ફોટિફાઇઝ પ્રજાતિઓ ઉપલબ્ધ છે.

### પ્રધાનમંત્રીના વ્યક્તાવ્યમાંથી મહિંત્વપૂર્ણ મુદ્દા

- છેદા કેટલાક વર્ષો દરમિયાન ભારત સહિત સમગ્ર વિશ્વમાં કૃષિ ઉત્પાદન વધારવા માટે, કુપોષણ નાબૂદ કરવા માટે અને પોષકતામાં વધારો કરવા માટે FAO દ્વારા મહિંત્વપૂર્ણ ભૂમિકા અદા કરવામાં આવી છે.
- FAOના વિશ્વ આહાર કાર્યક્રમે ચાલુ વર્ષ નોબલ શાંતિ પુરસ્કાર જીત્યો છે, જે એક મહિંત્વપૂર્ણ સિદ્ધિ છે. આપણે બધા જાળીએ છીએ કે જ્યારે વિશ્વ આહાર કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો ત્યારે ડૉ. બિનય રંજન સેન FAOના મહાનિદેશક હતાં.
- જ્યારે ભારતે આંતરરાષ્ટ્રીય યોગ દિનનો પ્રસ્તાવ 2જૂ કર્યો ત્યારે ભારત એકપણ રૂપિયાના ખર્ચ વગર વિશ્વના તમામ દેશોમાં સર્વગ્રાહી આરોગ્ય સુખાકારીનો ફેલાવો કરવા દરઢિતું હતું.
- કોરોના કટોકટીના છેદા કેટલાક મહિનાઓ દરમિયાન ભારત 80 કરોડ ગરીબોને વિનામૂલ્યે રાશન પૂર્ણ પાડી રહ્યું છે.
- 2014 સુધી ખાદ્ય સુરક્ષા કાયદો માત્ર 11 રાજ્યોમાં અમલી હતો અને માત્ર 2014 પછી તેનો સમગ્ર દેશમાં અસરકારક અમલ કરવામાં આવ્યો છે. ■

## હવે હિમાલયમાં ઉગેલી સ્વદેશી 'હિંગ'નો સ્વાદ ભાણો



**હિંગ** ગના સ્વાદ વગર ભારતીય રસોઈની કલ્પના કરવી મુશ્કેલ છે. ભારતમાં તે ખૂબ જ લોકપ્રિયતા ધરાવે છે. ભારત દર વર્ષે અફધાનિસ્તાન, ઈરાન અને ઉક્રાનિસ્તાનમાંથી આશરે 1,200 ટન કાચી હિંગની આચાત કરે છે, જેની પાછળ આશરે 100 મિલિયન ડોલરનો ખર્ચ થાય છે. હવે CSIRની અંગભૂત લેબોરેટરી અને પાલમપુર ખાતે આવેલી હિમાલય જૈવસંશાધન ટેકનોલોજી સંસ્થા (IHBT)ના પ્રયત્નો થકી હિંગની ખેતીની પદ્ધતિમાં ઔતિહાસિક ફેરફાર જોવા મળી રહ્યો છે. આ ક્ષેત્રના ઠંડા રણની પરિસ્થિતિમાં ખરાબાની જમીનના વિશાળ વિસ્તારનો ઉપયોગ કરવા હિમાચલ પ્રદેશમાં દૂરસ્થ લાહોલ ખીમના ખેડૂતોએ હિંગની ખેતી હાથ ધરી છે. CSIR-IHBT હિંગના બિયારણો લાવ્યાં છે અને તેની એગ્રો-ટેકનોલોજી વિકસાવી છે. ભારતમાં ફેરલા હિંગના છોડ રોપવાની સામગ્રીનો અભાવ આ પાકના વાવેતરમાં મુખ્ય સમસ્યા હતી.

### ભારત અને ખાદ્ય તથા કૃષિ સંગઠન

સંયુક્ત રાષ્ટ્રોનું ખાદ્ય અને કૃષિ સંગઠન (FAO) વિશિષ્ટ એજન્સી છે જેની સ્થાપના ઓક્ટોબર, 1945માં કરવામાં આવી હતી. આ સંસ્થા ભૂખમરો નાબૂદ કરવા અને પોષણ અને ખાદ્ય સુરક્ષામાં સુધારો કરવા આંતરરાષ્ટ્રીય પ્રયત્નો હાથ ધરતી વિશિષ્ટ સંસ્થા છે. ભારત FAO સાથે વિશેષ સંબંધ ધરાવતું હતું. ભારતીય રાજ્યાંરી અને ભારતીય નાગરિક સેવા અધિકારી બિનય રંજન સેન નવેમ્બર, 1956 અને ડિસેમ્બર, 1967ની વચ્ચે મહાનિદેશક હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 16 ઓક્ટોબર, 2020ના રોજ FAOના 75 વર્ષની ચાદગીરી રૂપે સ્મૃતિ સિક્કો બહાર પાડ્યો છે અને ભારતના 130 કરોડ લોકો વતી FAOની સેવાની ભાવનાનું સંજ્ઞાન કર્યું છે.

# પ્રકાશ અને અવાજ ના આદ્યગુરૂ

ભારતીય વિજ્ઞાનના ઇતિહાસમાં 1930નું વર્ષ વિશેષ સ્થાન ધરાવે છે કારણ કે આ વર્ષે સી. વી. રામને ભૌતિક શાસ્ત્રનો નોબલ પુરસ્કાર જીત્યો હતો અને નોબલ પુરસ્કાર જીતનારા ભારતના પ્રથમ વ્યક્તિ બની ગયા હતાં

જન્મ: 7 નવેમ્બર, 1888 મૃત્યુ: 21 નવેમ્બર, 1970



**સી. વી. રામનનો જન્મ** તિરચિરાપણીના એક સદગૃહસ્થ પરિવારમાં થયો હતો. રામને મેટ્રિકની પરીક્ષા માત્ર 11 વર્ષના ઉમેરે પસાર કરી હતી અને સુવર્ણ ચંદ્રક સાથે માત્ર 16 વર્ષના ઉમેરે ભૌતિક શાસ્ત્રમાં તેમનું સ્નાતક પૂર્ણ કર્યું હતું.

જ્યારે તેઓ હજુ તો તેમની ડિશોરાવપસ્થામાં હતાં ત્યારે તેમણે 1906માં બ્રિટિશ જનરલ 'ફિલોસોફિકલ મેગેઝિન'માં પ્રકાશના

જ્યારે પદાર્થના રાસાયણિક ઘટકના પારદર્શક નમૂનામાંથી પ્રકાશનું કિરણ પસાર થાય છે ત્યારે અલ્પ માત્રામાં પ્રકાશના કિરણનું પ્રક્રિયાન થાય છે. આ પ્રક્રિયાન પ્રકાશનો નાનો ભાગ પ્રકાશના ઉદ્ભવપસ્થાનથી અલગ તરંગ લંબાઈ ધરાવે છે. આને રામન ઈફ્કટ તરીકે ઓળખવામાં આવે છે.

પરાવર્તન ઉપર પ્રથમ વિજ્ઞાનિક નિબંધ પ્રકાશિત કર્યો હતો. પ્રવાહીની સપાઠીના તણાવ ઉપર તેમના ત્યારપણીના નિબંધે ખ્યાતનામ વિજ્ઞાનિક રેલિગને એટલા બધી પ્રભાવિત કર્યો હતા કે તેઓ રામનને આદરપૂર્વક "પ્રોફેસર" તરીકે સંબોધતા હતાં.

1907માં રામને પરીક્ષામાં સર્વોચ્ચ સ્તરે ઉત્તીર્ણ થઈને ભારતીય નાણાકીય સેવામાં સહાયક એકાઉન્ટન્ટ તરીકે જોડાયા હતા. પરંતુ કારકિર્દીમાં પરિવર્તન અને દેશમાં અપૂર્ણી સંશોધન સુવિધાઓ તેમની અંદર રહેલા વૈજ્ઞાનિકના આત્માને હરાવવામાં નિષ્ફળ રહી

હતી અને તેમણે પોતાના નવરાશના સમયમાં વિજ્ઞાનની ખોજ માટે ભારતીય સંગઠનમાં પોતાનું સંશોધન ચાલુ રાખ્યું હતું. 1917માં રમન પોતાની નોકરી છોડીન કલકત્તા ચુનિવર્સિટીમાં ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર તરીકે જોડાયાં હતાં.

1921માં જ્યારે તેમણે વિજ્ઞાન પરિષદની મુલાકાત માટે ઇંગ્લેન્ડની મુલાકાત લીધી ત્યારે તેમણે નોંધપાત્ર વેશ્વિક પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી લીધી હતી. પોતાના ઘરે પાછા ફરતી વખતે રસ્તામાં તેમણે દરિયાના વાદળી રંગની સમજ આપતી પ્રથમ નોંધપાત્ર ખોજ રજૂ કરી હતી, જે રેલિગ ક્ષારા રજૂ કરાયેલા સિક્કાતને રદિયો આપતી હતી. જોકે 1930માં રામન પ્રકિર્ણનના નામથી ઓળખાતી શોધે તેમને નોબલ પુરસ્કાર અપાવ્યો હતો. રામન ઈફ્કટ પ્રવાહી, વાયુ અને ધન પદાર્થના વિશ્લેષણમાં એટલી બધી મહત્વપૂર્ણ હતી કે 1998માં અમેરિકન કેમિકલ સોસાયટી ક્ષારા તેને રાષ્ટ્રીય ઐતિહાસિક કેમિકલ સીમાચિહ્ન નિર્ધારિત કરવામાં આવી હતી. ચંદ્રની સપાઠી ઉપર ચંદ્ર્યાન-1 ક્ષારા પાણીની શોધમાં રામન પ્રકિર્ણને મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી.

રમને વિવિધ વાયોલિન અને તેની સાથે સંબંધિત વાધોની ધ્વનિશાસ્ત્રનો અભ્યાસ કરીને તેમના સંગીતના અવાજના ભૌતિકશાસ્ત્રમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે. 1954માં તેમને ભારત રટનથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. 28મી ફેબ્રુઆરી, 1928ના રોજ રામન ઈફ્કટની ખોજની સ્મૃતિરૂપે દર વર્ષે આ દિવસ રાષ્ટ્રીય વિજ્ઞાન દિન તરીકે ઉજવવામાં આવે છે. ■

“

જ્યારે નોબલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી ત્યારે તેને મેં વ્યક્તિગત વિજ્ઞાન તરીકે જોયો, તે મારા અને મારા સહયોગીઓ માટે એક સિક્કિ છે... જ્યારે મને રાજી ગુસ્તાવ તરફથી પુરસ્કાર મળ્યો ત્યારે હું ખૂબ જ ફૂટજાતા અનુભવ હતો, તે ખૂબ જ લાગણીશિલ ક્ષાણ હતી પરંતુ મેં મારા ઉપર નિયંત્રણ રાખ્યું હતું.

સી. વી. રામન

”

# નવા ભારતનો મંત્ર: લોકો દ્વારા લોકશાહી, સરકાર દ્વારા સુશાસન

અખંડ ભારતના નિર્માણમાં સરદાર પટેલે ખૂબ જ મહત્વની ભૂમિકા નિભાવી હોવાથી તેઓ 'અખંડ ભારતના શિલ્પી' તરીકે ઓળખાય છે. સરકાર 2014થી, ભારત 31 ઓક્ટોબર એટલે કે સરદાર પટેલની જન્મજયંતિને 'રાષ્ટ્રીય એકતા દિવસ' તરીકે ઉજવે છે



**સ**રદાર વધ્યભાઈ પટેલ માત્ર ભારતના પ્રથમ ગૃહમંત્રી નહોતા પરંતુ તેઓ 'અખંડ ભારતના શિલ્પી' પણ હતા. તેમની 145મી જન્મજયંતિ નિમિત્તે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને સ્મરણાંજલિ આપી હતી અને "ભારતમાં સુશાસન@100" નો મંત્ર આપ્યો હતો — એટલે કે જ્યારે ભારત તેની સ્વતંત્રતાના 100 વર્ષની ઉજવણી કરશે ત્યારે, 'લોકો દ્વારા લોકશાહી, સરકાર દ્વારા સુશાસન' હોયું જોઈએ.

31 ઓક્ટોબર 2020ના રોજ ભારતીય જાહેર સેવાના તાલીમાર્થી અધિકારીઓને સંબોધની વેળા પ્રધાનમંત્રીએ તેમને દેશના લોકોની સેવા કરવા માટે સરદાર પટેલની ફિલસુઝી અનુસરવાનો અનુરોધ કર્યો હતો જેમાં કહ્યું છે કે, દેશવાસીઓની સેવા એ જાહેર સેવાધિકારીઓની સર્વોપરી ફરજ છે.

**પ્રધાનમંત્રીના સંબોધનના મહત્વપૂર્ણ મુદ્દા**

- ભારત એક ભારત શ્રેષ્ઠ ભારત; આત્મનિર્ભર ભારત

અને નવીન ભારતના નિર્માણ તરફ સ્થળાંતરનું સાક્ષી બની રહ્યું છે.

- ભૂતકાળથી વિપરિત, હવે માનવ સંસાધનોની તાલીમમાં અધતન અભિગમો પર ભાર મૂકવામાં આવે છે
- ટોપ-ટાઉન અભિગમ રાખવાથી સરકાર ના ચાલી શકે. જેમના માટે નીતિઓ ઘડવામાં આવે છે તે લોકોની આમાં ભાગીદારી ખૂબ મહત્વની છે. સરકાર પાછળનું સાચું ચાલક બળ જનતા જ છે
- આજે 130 કરોડ દેશવાસીઓ એકજૂથ થઈને એવા રાષ્ટ્રનું નિર્માણ કરી રહ્યાં છે જે મજબૂત અને સક્ષમ છે, જ્યાં સમાનતા અને તકો છે
- માત્ર આત્મનિર્ભર રાષ્ટ્રમાં જ પોતાની પ્રગતિ અને સુરક્ષા માટે આત્મવિશ્વાસ હોઈ શકે છે. દેશ સંરક્ષણ સહિત વિવિધ ક્ષેત્રોમાં આત્મનિર્ભર બનાવાની દિશામાં આગળ વધી રહ્યો છે
- ભારતની એકતા એવી તાકાત છે જેનાથી અન્ય લોકોને પોતાના ટેરવે રાખી શકે છે. કેટલાક લોકો આ વિવિધતાને નબળાઈ બનાવવા માંગે છે. ભારતે આવી શકિતાનોને પારખવાની અને સતર્ક રહેવાની જરૂર છે
- ભારત સરહદી વિસ્તારોમાં સેંકડો કિલોમીટરના માર્ગો, ડાઝનબંધ પૂલો અને સંખ્યાબંધ સુંંગોનું નિર્માણ કરી રહ્યું છે. આજે, ભારત પોતાના સાર્વભૌમત્વ અને અખંડિતાનું રક્ષણ કરવા માટે સંપૂર્ણ સજ્જ છે
- કાશ્મીરના વિકાસના માર્ગમાં આવતા અવરોધોને પાછળ રાખીને હવે કાશ્મીર વિકાસના નવા માર્ગ આગળ વધ્યું છે. દેશ એકતાના નવા પરિમાણો સ્થાપી રહ્યો છે
- શાંતિ, ભાઈચારા અને પારસ્પરિક આદરની ભાવના માનવતાની ખરી ઓળખ છે. ત્રાસવાદ કે હિંસાથી કોઈનું ભલું થઈ શકે નહીં.
- ભારત પુલવામા હુમલાને ક્યારોય ભૂલી શકશે નહીં. આ ઘટના અંગે કરવામાં આવેલા નિવેદનોને દેશ ક્યારોય ભૂલશે નહીં. તાજેતરમાં પડોશી રાષ્ટ્રની સંસદમાં થયેલા નિવેદનોથી તથય બહાર આવ્યું છે.

તમારા સ્વાર્થ ખાતર જાણતા કે અજાણતા દેશ વિરોધી તાકાતોની કઠપૂતળી બનીને, તમે ના તો દેશના હિતમાં કામ કરી શકશો, ના પાર્ટીના હિતમાં કરી શકશો.

## સ્ટેર્ચ્યુ ઓફ યુનિટીની આસપાસમાં વિકાસના નવા કાર્યો

**આરોગ્ય વન** 17 એકરમાં બનેલું છે જ્યાં અલગ અલગ 380 પ્રજાતિના પલાખ છોડ છે

**આરોગ્ય કુટીરને** શાંતિગીરિ સુખાકારી કેન્દ્ર નામ આપીને ત્યાં પરંપરાગત સારવાર કરવામાં આવે છે. ત્યાં આયુર્વેદ, સિદ્ધ, યોગ અને પંચકર્મ આધારિત આરોગ્ય સંભાળ પૂરી પાડવામાં આવશે.

**એકતા મોલમાં** સમગ્ર ભારતમાંથી હસ્તકામ અને પરંપરાગત ચીજઘસ્તુઓની વૈવિધ્યપૂર્ણ શ્રેણી પ્રદર્શિત કરવામાં આવી છે. તે 35,000 ચોરસ ફૂટમાં બનેલો છે

**ચિલ્દ્રન ન્યૂટ્રીશન પાર્ક** દુનિયામાં બાળકો માટે આ પ્રકારનો પ્રથમ ટેકનોલોજીથી ચાલિત પોષણ પાર્ક છે જે 35,000 ચોરસ ફૂટ ક્ષેત્રફળમાં ફેલાયેલો છે

**જૃગાલ સફારી** પોતાના વર્ગમાં શ્રેષ્ઠ જુઓલોજિકલ પાર્ક છે જે 375 એકરમાં પથરાયેલો છે. તેમાં 29થી 180 મીટરના સાત અલગ અલગ સ્તર આવે છે. તેમાં 1,100થી વધુ પક્ષીઓ અને અને પ્રાણીઓ તેમજ 5 લાખથી વધુ છોડ છે

**યુનિટી ગ્લો ગાર્ડન** એક અનોખો થીમ પાર્ક છે જે 3.61 એકરમાં ફેલાયેલો છે. તેમાં વિવિધ કલાકૃતિઓ, રચનાઓ અને ઓપ્ટિકલ ઇલ્યુઝનના સંખ્યાબંધ આકર્ષણો રાખવામાં આવ્યા છે

**કેકટસ ગાર્ડન** એક ભવ્ય આન્ડ્રોઇડ ગ્રીનહાઉસ છે જ્યાં 17 દેશોમાંથી 450 રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રજાતિઓ રાખવામાં આવી છે. અહીં 25 એકર ક્ષેત્રફળમાં 1.9 લાખ થોરના છોડ સહિત અંદાજે 6 લાખ છોડ ઉછેરવામાં આવ્યા છે.

**સી-પ્લેન સેવા** કેવડિયા ખાતે સ્ટેર્ચ્યુ ઓફ યુનિટી અને અમદાવાદમાં સાબરમતી રિવરફન્ટને જોડે છે. સી-પ્લેન પાણી પર લેન્ડિંગ અને ટેકઓફ કરી શકે છે. આમ, જ્યાં જમીન પર એકસ્ટ્રીપ અથવા રનવે શક્ય ના હોય તેવા વિસ્તારોમાં આ પ્લેનથી પહોંચી શકાય છે. ■



રાષ્ટ્રીય એકતા દિવસ  
નિમિત્તે પ્રધાનમંત્રીનું સંપૂર્ણ  
સંબોધન સંભળવા માટે  
QR કોડ સ્કેન કરો.



પ્રશાસનિક સેવાઓના  
અધિકારીઓ સાથે  
પ્રધાનમંત્રીનો સંવાદ સંભળવા  
માટે QR કોડ સ્કેન કરો.

# ગ્રાન્ડ ચેલેન્જસ વાર્ષિક બેઠક 2020



પ્રધાનમંત્રીનું  
સંપૂર્ણ સંબોધન  
સંભળવા માટે QR  
કોડ સ્કેન કરો

**વિશ્વાસીની જીવનના નવા કાર્યો** જીાન અને નવાચાર માનવ જીવનના લગભગ તમામ પરિબળોને સ્પર્શે છે અને કોવિડ-19ના સમયમાં તેનું મહત્વ ધાર્યું વધી ગયું છે. ગ્રાન્ડ ચેલેન્જસ વાર્ષિક બેઠક 2020માં પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ સંદેશો આપ્યો હતો કે, એવો સમાજ ભવિષ્યનું ઘડતર કરશે જે વિજાન અને નવાચારમાં રોકાણ કરતો હોય. આમ તો, આ બેઠક ભારતમાં પ્રત્યક્ષરૂપે યોજવાની હતી પરંતુ મહામારીના કારણે વર્યુઅલ માધ્યમથી તેનું આયોજન થયું હતું. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “ટેકનોલોજીમાં એક એવી તાકાત છે કે વૈશ્વિક મહામારી પણ આપણને અલગ પાડી શકતી નથી. આ કાર્યક્રમ તેના શિક્ષ્યુલ અનુસાર આગળ વધ્યો છે... તે નવું અપનાવવા અને નવી શોધો કરવા માટેની આપણી પ્રતિબદ્ધતા દર્શાવે છે”.

## ગ્રાન્ડ ચેલેન્જસ વાર્ષિક બેઠક 2020 શરૂ છે?

આ વર્ષ 19થી 21 ઓક્ટોબર દરમિયાન આ વાર્ષિક બેઠકનું આયોજન થયું હતું. આ કાર્યક્રમમાં “દુનિયા માટે ભારત” વિચાર સાથે ખાસ કરીને કોવિડ-19 પર ભાર મૂકીને વૈશ્વિક આરોગ્ય સમસ્યાઓના ઉકેલ માટે વૈજ્ઞાનિક સહયોગ વધુ ઘનિષ્ઠ બનાવવાના આહાન સાથે આમાં 40 દેશોના 1,600 નીતિ નિર્માતાઓ અને વૈજ્ઞાનિક અગ્રણીએ એકમંચ પર ભેગા થયા હતા.

## સૌર ઉર્જા

# બહેતર ભવિષ્ય માટે સ્વરચ્છ ઉર્જાનો સંકલપ

અશિમગત ઈંદ્રણોએ માનવજાતના એકમાત્ર 'ધર'ને જોખમમાં મૂકીને પૃથ્વી પર ઉર્જાના સૌપ્રથમ અને છેવટના ઉર્જા સોત એવા સૂર્ય તરફ ફરી નજર માંડવા માટે ફરજ પાડી છે. હરિત અથવા અક્ષય ઉર્જા સમગ્ર દુનિયાનું દ્યાન જેંચી રહી છે. અક્ષય ઉર્જા વધુ સસ્તી; વધુ ભરોસાપાત્ર; અને ટ્રાન્સમિશન ગ્રીડ સાથે જોડાવામાં વધુ સરળ બને તે માટે દેશોએ વધુ સંશોધન અને નવાચાર કરવાની જરૂર છે

**મ**રતમાં પ્રકૃતિને માતાનું બિરુદ આપવામાં આવ્યું છે અને સદીઓથી દેશો માનવજાતને પ્રકૃતિ કરતાં ચાઢિયાતી નહીં પરંતુ તેના એક હિસ્સા તરીકે જોઈ છે. પ્રકૃતિ પ્રત્યેના ભારતના અભિગમને અથર્વવેદમાં આપેલા સુક્તા: માતા ભૂમી: પુત્રોહં પૃથીવ્યા: થી બહેતર બીજું કંઈ જ વર્ણવી શકે નહીં જેનો અર્થ છે 'આ પૃથ્વી અમારી માતા છે અને તમે તેમના સંતાન છીએ'.

ભારતીય પરંપરામાં સૂર્યને તમામ પ્રકારની ઉર્જાનો સોત માનવામાં આવે છે. સૌર ઉર્જા દુનિયાને ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનાવી શકે છે અને પર્યાવરણને સ્વરચ્છ રાખવામાં પણ મદદરૂપ થઈ શકે છે. આ દિશામાં, ભારત અને ફાન્સે આગળ આવીને 2015માં આંતરરાષ્ટ્રીય સૌર સંગરન (ISA)નો પ્રારંભ કર્યો છે. આનાથી સૌર ઉર્જાને વધુ સસ્તી, ભરોસાપાત્ર અને ગ્રીડ સુધી સરળતાથી પહોંચાડીને લોકોના જીવન બહેતર બનાવવા માટે તેનો ઉપયોગ કરવામાં મદદ મળશે.

**“** અમે હંમેશાા એવું માનીએ છીએ કે, માનવજાતના કારણે પ્રકૃતિનું અસ્તિત્વ નથી પરંતુ પ્રકૃતિના કારણે માનવજાતનું અસ્તિત્વ છે. આથી, પ્રકૃતિનું શોખણ કરવાના બદલે તેનું જતન કરવું જોઈએ. જ્યારે પ્રકૃતિ સમાનતાની સ્થિતિમાં હશે ત્યારે જ આપણા જીવન અને દુનિયામાં સંતુલન આવશે.”

પ્રધાનમંત્રીએ 20 નવેમ્બર 2015ના રોજ COP૨૧ ખાતે ભારતીય પેવેલિયનને સંબોધતી વખતે કહેલા શબ્દો.





સત્ય દેશોએ 14 ઓક્ટોબરના રોજ વર્ષ્યુઅલ માદ્યમથી યોજાયેલી ISAની સભામાં ભાગ લીધો હતો.

#### 40 દેશોમાંથી વધીને 68 થચા અને હજુ પણ વધી રહ્યા છે

ISAની પ્રથમ સભા ઓક્ટોબર 2018માં યોજવામાં આવી હતી અને તેમાં 40 દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. જોકે, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ સંગઠને એવી દિશામાં આગળ વધવાની જરૂર છે જ્યાં સૌર ઉર્જાના વિકલ્પો મકરવૃત્ત ઉંઘા કટીબદ્ધ ક્ષેત્રમાં આવેલા માત્ર 100થી 125 દેશો પૂરતા સિમિત ના હોય પરંતુ તેનાથી સમગ્ર દુનિયાને ફાયદો થાય. ISA હવે ગૌરવલેર 68 સત્ય દેશોનું સંગઠન બની ગયું છે અને તેમાં વધુ 20 દેશો તેના સત્ય બનવાની પ્રક્રિયા હેઠળ છે.

#### બિન-અશ્રિત ઈંદ્ધણથી 175 ગીગાવોટ વિદ્યુત

ભારતે વર્ષ 2030 સુધીમાં બિન-અશ્રિત ઈંદ્ધણના સોતોમાંથી પોતાની ખપતના 40 ટકા વિદ્યુતનું ઉત્પાદન કરવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. ભારતે છેણા ચાર વર્ષમાં અક્ષય ઉર્જા ઉત્પાદનની ક્ષમતા બે ગણી વધારીને 72 ગીગાવોટ કરી દીધી છે. સૌર ઉર્જા ક્ષમતા પણ નવ ગણી વધી ગઈ છે. વર્તમાન સમયમાં, બિન-જળવિદ્યુત અક્ષય ઉર્જા ભારતમાં કુલ વિદ્યુત ઉત્પાદનમાંથી 20 ટકા હિસ્સો ધરાવે છે. હવે, ભારત 2022 સુધીમાં 175 ગીગાવોટ વિદ્યુતના ઉત્પાદનના માર્ગે આગળ વધી રહ્યું છે. ■

## ISA શું છે?

**આ** તરાષ્ટ્રીય સૌર સંગઠન (ISA) કર્કવૃત અને મકરવૃતની વર્ચેના ક્ષેત્રમાં આવેલા સંપૂર્ણ અથવા આંશિક રીતે સૌર સંસાધનથી સમૃદ્ધ દેશોનું સંગઠન છે. 2015માં ફાન્સના પેરિસમાં આબોહવા પરિવર્તન અંગે સંયુક્ત રાષ્ટ્રસંઘ ફેમવર્ક સમેલનમાં 21ની પક્ષોની પરિષદ (CoP)ની સાથે સાથે, 30 નવેમ્બર 2015ના રોજ ભારત અને ફાન્સ દ્વારા સંયુક્ત રીતે અહીં ISAનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. 15 નવેમ્બર 2016ના રોજ મોરોકોના મારકિય ખાતે CoP-૨૨ની સાથે સાથે, ISA ફેમવર્ક કરારને હસ્તાક્ષર કરવા માટે ખુદો મૂકવામાં આવ્યો હતો.

દૂરેંદેશી, મિશન અને હેતુ: ISAની દૂરેંદેશી અને મિશન મકરવૃત અને કર્કવૃતની વર્ચે આવેલા સંપૂર્ણ અથવા આંશિક રીતે સૌર સંસાધનથી સમૃદ્ધ દેશોને પારસ્પરિક સહકાર માટે એક સમર્પિત મંચ પૂરો પાડવાનું છે. સંભવિત ISA સત્ય દેશોના સૌર ઉર્જાના વધતા વપરાશની જરૂરિયાતો સલામત, અનુકૂળ, પરવડે તેવા દરે, સમાન રીતે અને ટકાઉશ્મ રીતે પૂરી કરવા માટેના સહિત્યારા લક્ષ્યમાં સહાયરૂપ થવા અને મદદ કરવા માટે ડ્રિપક્ષીય અને બહુપક્ષીય સંગઠનો, કોર્પોરેટ્સ અને ઉદ્યોગો સહિત વૈશ્વિક હિતધારકોને સહકાર આપવાનો પણ ઉદ્દેશ છે. ISAનો હેતુ સત્ય દેશોને કાર્યાન્વિત કરવાનો, આંતરાષ્ટ્રીય સંગઠનો પાસેથી પ્રતિબદ્ધતા મંગવાનો અને ખાનગી ક્ષેત્રોને સક્રિય કરવાનો, ત્રામીએ અને વિકેન્ઝિટ એપિલેકેશનોને સહકાર આપવાનો, પરવડે તેવા ફાઈનાન્સ સુધીની પહોંચ આપવાનો, ટાપુઓ અને ગામડાંઓમાં સોલર મિની ગ્રીડ નાંખવાનો, રૂપટોપ ઇન્સ્ટોલેશન ઉભા કરવાનો અને સૌર ઈ-મોબોલિટી ટેકનોલોજીને આગળ વધારવાનો છે.

ISA દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રવૃત્તિઓ અને કાર્યક્રમ

- સૌર ઉર્જાના વિવિધ પરિબળોને આવરી લેતા છે કાર્યક્રમો અને બે પરિયોજનાઓ પર કામ ચાલી રહ્યું છે
- ISA સત્ય દેશોમાં વીજળી, સિંચાઈ, પીવાલાયક પાણી અને ઉત્પાદક ઉર્જા જરૂરિયાતોને પહોંચી વળવા માટે સૌર ઉર્જા એપિલેકેશનોનો ઉપયોગ કરવા \$૫ અબજથી વધુ ખર્ચે મજબૂત પાઈપલાઇન તૈયાર કરવામાં આવી છે
- ISA પાસે 22 દેશોમાં 2,70,00થી વધારે સોલર પમ્પ, 11 દેશોમાં 1 GWથી વધારે સોલર રૂપટોપ અને 9 દેશોમાં 10 GWથી વધારે સોલર મિની-ગ્રીડની કુલ માંગ છે સંભવિત કાર્યક્રમ અંતર્ગત છે
- 2030 સુધીમાં \$1 ટ્રિલિયનની રકમ કાર્યાન્વિત કરવા માટે તેમણે આચોજન ધર્યું છે

# દેશવાસીનું વધુ સશક્તિકરણ

તાજેતરમાં મંત્રીમંડળ છારા લેવામાં આવેલા નિર્ણયોથી જમ્મુ-કાશ્મીરના લોકો માટે સ્થાનિક સ્પરાજનું સપનું સાકાર થવાની સાથે સાથે કેન્દ્ર સરકારના કર્મચારીઓને બોનસ અને ઓઈલ માર્કેટિંગ કંપનીઓને ઈથેનોલની ખરીદીની અનુમતિથી બજારમાં વધુ નાણાં પ્રવાહ આવશે અને દેશનું અર્થતંત્ર વધુ વેગવાન થશે

**નિર્ણય:** જમ્મુ અને કાશ્મીર પંચાયતી રાજ અધિનિયમ 1989 અપનાવવા માટે મંજૂરી જેથી ત્રિસ્તરીય સ્થાનિક સ્પરાજની સ્થાપના થઈ શકે.

**ફાયદા:** આ નિર્ણયથી જમ્મુ અને કાશ્મીરમાં પાચાના સ્તરે તમામ ત્રિ-સ્તરીય લોકશાહીની સ્થાપના થશે. આ કેન્દ્ર શાસિત પ્રદેશમાં દેશના અન્ય ભાગોની જેમ સ્થાનિક લોકો છારા સીધા જ પ્રતિનિધિઓ ચુંટવામાં આવશે. જમ્મુ અને કાશ્મીરમાં તમામ ત્રણ સ્તરમાં પંચાયત, તાલુકા અને જિલ્લા સ્તરે વહેલી ચુંટણી ચોજવામાં આવશે. જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 નાબૂદી પહેલાંના સમયમાં ત્રણ સ્તરીય પ્રણાલી અસ્તિત્વમાં નહોતી. આમ, લોકોને તેમના સ્થાનિક પ્રતિનિધિઓ ચુંટવાની તક પ્રાખ નહોતી થતી.

**નિર્ણય:** કેન્દ્ર સરકારના 30 લાખથી વધુ કર્મચારીઓ માટે રૂ. 3,737 કરોડ બોનસને મંજૂરી

**ફાયદા:** રેલવે, પોસ્ટ, સંરક્ષણ, EPFO, ESIC વગેરે વ્યાપારી સંગठનોમાં 16.97 લાખ બિન-રાજ્યપત્રિત કર્મચારીઓને વર્ષ 2019-20 માટે ઉત્પાદકતા લિંકડ બોનસ (PLB) આપવામાં આવશે. બોનસ પેટે રૂ. 2,791 કરોડ ચુકવવામાં આવશે. નોન-PLB અથવા હંગામી બોનસ પેટે 13.70 લાખ બિન-રાજ્યપત્રિત કર્મચારીઓને બોનસ આપવા માટે સરકાર પર રૂપિયા 946 કરોડનો બોજો આવશે. કુલ રૂ. 3,737 કરોડના આર્થિક ખર્ચના આ નિર્ણયથી 30.67 લાખ કર્મચારીઓને લાભ થશે.

**નિર્ણય:** મંત્રીમંડળે જાપાન સાથે માહિતી અને કમ્યુનિકેશન ટેકનોલોજીમાંના ક્ષેત્રમાં ડ્રિપક્ષીય સહકાર માટે MoCને મંજૂરી આપી.

**ફાયદા:** આ MoCથી કમ્યુનિકેશનના ક્ષેત્રમાં ડ્રિપક્ષીય સહકાર અને પારસ્પરિક સમજણ વધુ મજબૂત બનશે. તે ભારત માટે એક વ્યૂહાત્મક પહેલ બની રહેશે કારણ કે જાપાન "વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારી"ની



**નિર્ણય:** જાહેર ક્ષેત્રની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ છારા ઈથેનોલની ખરીદી માટેના વ્યવસ્થાતંત્રને મંજૂરી

**ફાયદા:** આ નિર્ણયથી શેરકીના ખેડૂતો અને ઈથેનોલ ઉત્પાદકોને લાભ થશે. શેરકીમાંથી ઉત્પાદિત ઈથેનોલ માટે નિર્ધારિત કરવામાં આવેલા નવી કિંમત રૂ. 62.65 પ્રતિ લીટર છે. 'B' ભારે ગોળના રસમાંથી ઉત્પાદિત કરવામાં આવેલા ઈથેનોલની કિંમત રૂ. 57.61 પ્રતિ લીટર છે. 'C' ભારે ગોળના રસમાંથી ઉત્પાદિત કરવામાં આવેલા ઈથેનોલની કિંમત રૂ. 45.69 પ્રતિ લીટર છે. 2014માં ઓઈલ કંપનીઓને 38 કરોડ લીટર ઈથેનોલનો પૂરવઠો આપવામાં આવ્યો હતો જે ગત વર્ષ વધીને 195 કરોડ લીટર થઈ ગયો હતો. ઈથેનોલથી પર્યાવરણનું પ્રદૂષણ ઘટાડવામાં મદદ મળે છે અને વિદેશી હુંડિયામણની બચતની સાથે સાથે ખેડૂતોની આવક વધે છે.

સ્થિતિ સાથે ભારતનું મહત્વપૂર્ણ ભાગીદાર છે. આ MoCથી બંને દેશો વર્ચે 5 નેટવર્ક, ટેલિકોમ સુરક્ષા, સબમરીન કેબલ, કમ્યુનિકેશન ઉપકરણોની માપદંડ પ્રમાણિતા, અધ્યતન વાયરલેસ ટેકનોલોજી અને ICTનો ઉપયોગ, ICT ક્ષમતા નિર્માણ, જાહેર સુરક્ષા અને આપત્તિ રાહત, આટિફિશિયલ ઈન્ટેલિજન્સ / બ્લોક ચેઇન, સ્પેક્ટ્રમ શ્રુંખલા, સ્પેક્ટ્રમ વ્યવસ્થાપન,

**નિર્ણય:** શાણની સામગ્રીમાં ફરજિયાત પેકેજિંગના માપદંડો લંબાવવા માટે મંજૂરી



**ફાયદા:** એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે 100 ટકા ખાદ્યત અને 20 ટકા ખાંડનું ફરજિયાતપણે વિવિધ પ્રકારની શાણની થેલીઓમાં કરવાનું રહેશે. આ નિર્ણયથી શાણ ઉદ્યોગના વૈવિદ્યકરણને ખૂબ જ વેગ મળશે. વધુમાં, આ નિર્ણય એવો પણ આદેશ કરે છે કે, શરૂઆતમાં ખાદ્યતના પેકેજિંગ માટે શાણની થેલીઓની 10 ટકા માંગ GEM પોર્ટલ પર ઉલ્લટી હરાજુ ઢ્રારા મૂકવામાં આવશે. આનાથી કિંમત શોધના કાયદાનો તબક્કાવાર અમલ થશે. આનાથી શાણના ખેડૂતોને વધુ કમાણી કરવામાં મદદ મળશે.

બહુપદ્ધીય મંચો પર સહકાર વગેરે જેવા ક્ષેત્રોમાં સહકારમાં મદદ મળશે.



**નિર્ણય:** વર્ષ 2020–21 માટે જમ્મુ અને કાશ્મીરમાંથી સફરજનની ખરીદી માટે બજારમાં હસ્તક્ષેપ યોજના લંબાવવાની મંજૂરી.

**ફાયદા:** સરકાર આ યોજના અંતર્ગત વર્તમાન મોસમ એટલે કે 2020–21 દરમિયાન ગત મોસમમાં નક્કી કરવામાં આવેલા નિયમો અને શરતોના પાલન સાથે 12 લાખ મેટ્રિક ટન સફરજનની ખરીદી કરશે. કેન્દ્ર સરકારની એજન્સી એટલે કે રાષ્ટ્રીય કૃષિ સહકારી માર્કેટિંગ સંઘ લિમિટેડ (નાફેડ) ઢ્રારા રાજ્યમાં નિયુક્ત એજન્સી એટલે કે જમ્મુ અને કાશ્મીર બાગાયત પ્રસંસ્કરણ અને માર્કેટિંગ સહકારી મંડળીના બાગાયત વિભાગ આયોજન અને માર્કેટિંગ નિદેશાલય ઢ્રારા સીધી ખેડૂતો પાસેથી જ સફરજનની ખરીદી કરવામાં આવશે.

સરકારે નાફેડને આ કામગીરી માટે રૂ. 2,500 કરોડની સરકારી બાંહેદરીનો ઉપયોગ કરવાની પણ અનુમતિ આપી છે. જો કોઈ નુકસાન થાય તો, કેન્દ્ર સરકાર અને જમ્મુ-કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ વહીવટીતંત્ર સંયુક્ત રીતે 50:50ના ધોરણે ભોગવશે.

**નિર્ણય:** બાધ્ય સહાયિત ડેમ પુનર્વસન અને સુધારણા પરિયોજના (DRIP) – તબક્કો – II અને તબક્કો – IIIને મંત્રીમંડળની મંજૂરી.

**ફાયદા:** રૂપિયા 10,211 કરોડની આ પરિયોજનાનો અમલ એપ્રિલ 2021થી કરવામાં આવશે. આનાથી દેશમાં પસંદ કરવામાં આવેલા 736 ડેમની સલામતી અને પરિચાલન કામગીરીમાં સુધારો આવશે. ભારતમાં 5,334 ડેમ છે, સાથે 411 નવા ડેમનું નિર્માણ થઈ રહ્યું છે. અમેરિકા અને ચીન પછી સર્વાધિક ડેમ ધરાવતો ભારત ત્રીજો દેશ છે. વિદ્યુત ઉત્પાદન, સિંચાઇ અને પીવાલાયક પાણીના પૂરવઠા માટે ડેમ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે.

**નિર્ણય:** ભારત અને ક્રમબોડિયા વરચે આરોગ્ય અને ચિકિત્સા ક્ષેત્રે સહકાર માટે સમજૂતી કરાર (MoU)ને મંજૂરી.

**ફાયદા:** આ MoUથી બંને દેશો વરચે આરોગ્ય ક્ષેત્રમાં ટેકનોલોજી વિકાસ માટેની સંયુક્ત પહેલો ઢ્રારા પારસ્પરિક સહકારને પ્રોત્સાહન મળશે.

**નિર્ણય:** ભારતના ICAI અને પાપુઆ ન્યૂ ગિનિયાના CPA વરચે MoU પર હસ્તાક્ષર.

**ફાયદા:** ભારતીય ચાર્ટેડ એકાઉન્ટન્ટ્સ સંસ્થા (ICAI) અને સાર્ટિફાઇડ પ્રેક્ટિસિંગ એકાઉન્ટન્ટ્સ, પાપુઆ ન્યૂ ગિનિયા (CPA PNG) કોર્પોરેટ ગવર્નર્સ, ટેકનિકલ સંશોધન અને સલાહ, ગુણવત્તા ખાતરી, ફોરેન્સિક એકાઉન્ટિંગ, અવિરત પ્રોફેશનલ વિકાસ (CPD) અને અન્ય પારસ્પરિક હિતોના વિષયો પર સંભવિત સહકાર સ્થાપવા માટે સાથે મળીને કામ કરશે. તેઓ ભારત અને PNG વરચે એકાઉન્ટિંગના વ્યવસાય સાથે સંબંધિત બિનપ્રતિબંધિત માહિતીનું આદાનપ્રદાન કરશે. ■



21 ઓક્ટોબર

મંત્રીમંડળના નિર્ણયોનું સંપૂર્ણ

સંબોધન સાંભળવા માટે

QR કોડ સ્કેન કરો.



29 ઓક્ટોબર

મંત્રીમંડળના નિર્ણયોનું સંપૂર્ણ

સંબોધન સાંભળવા માટે

QR કોડ સ્કેન કરો.

# બાળકો માટે નવી પચોફનો અનુષ્ઠાનિક

નાભિયેરીના પાંદડામાંથી બનાવેલી સ્ટ્રો અને અનુષ્ઠાનિક પ્રદેશમાં શાળાની એક શિક્ષિકા છારા રસ્તા પર શરૂ કરવામાં આવેલા પુસ્તકાલયથી કંઈક અનોખું વિચારવાના દ્વારાંતો જળકી રહ્યાં છે

## ઇંડાનગરમાં રસ્તા પર પુસ્તકાલય



**રૂ** અણાચલ પ્રદેશના નિર્જુલીમાં રહેતા 30 વર્ષીય શિક્ષિકા ન્યુંરાંગ મીનાએ રસ્તા પર અદ્ભૂત પુસ્તકાલય શરૂ કર્યું છે. મીના જ્યાં રહે છે તે વિસ્તારમાં રહેતા બાળકોનું બોર્ડની પરીક્ષામાં ખૂબ જ નિરાશાજનક પરિણામ આવ્યા પછી તેમના મનમાં આ નવતર વિચાર જબક્યો હતો. સોશિયલ મીડિયાના માધ્યમથી, તેમને મિક્રોરમમાં રસ્તા પર ચાલતા પુસ્તકાલય વિશે માહિતી મળી જે બાળકોને ખૂબ આકર્ષણી હતું. આનાથી તેમના મનમાં પણ નિર્જુલી શહેરમાં આવું જ પુસ્તકાલય શરૂ કરવાનો વિચાર આવ્યો.

નિરક્ષર માતા અને મેટ્રિક પાસ પિતાના સંતાન મીના એ વાત જાણતા હતા કે તેમના વ્યક્તિત્વ વિકાસમાં વાંચનની આદતે કેટલો ફાળો આપ્યો છે. તેમણે બાળકોને તેમના સ્માર્ટફોનની દુનિયામાંથી ઉગારીને પ્રિન્ટ વર્લ્ડમાં લઈ જવાનો નિર્ધાર કર્યો. પુસ્તકો અને તેને રાખવા માટેના કબાટ પાછળ લગભગ રૂ. 20,000 ખર્ચીને તેમણે રસ્તા પર પુસ્તકાલયનો પ્રારંભ કર્યો. મીના ઈરછે છે કે, બાળકો અને ડિશોરોમાં વાંચનની આદત કેળવાય અને તેમને વાંચવાનું ગમે તેવી લાગણી પણ વિકસે. તેમનું આ પુસ્તકાલય બાળકો ઉપરાંત મોટા લોકોને પણ આકર્ષી રહ્યું છે. અગાઉ, જે પુસ્તક પ્રેમીઓ પુસ્તક ખરીદવાનો ખર્ચ ઉપાડી શકતા નહોતા તેમને સરકારી પુસ્તકાલયોમાં જવું પડતું હતું. રસ્તા પરના આ પુસ્તકાલયથી બાળકોમાં વાંચનની આદત વધવાની સાથે સાથે તેમના માતાપિતામાં પણ પુસ્તકોમાંથી લાંબા સમયથી જતો રહેલો રસ ફરી જાગ્યો છે. ખાસ કરીને જેઓ પુસ્તકો ખરીદી શકે તેમ નથી તેઓ આ પુસ્તકાલયમાં વધુ રસ લઈ રહ્યાં છે.

## નાભિયેરના પાંદડાની સ્ટ્રો વૈજ્ઞિક બ્રાન્ડ બની ગઈ



**જ** ઝરિયાત એ સંશોધનની જનેતા છે તે કહેવતને સાર્થક કરતા, બેંગલુરુના પ્રોફેસર સાણુ વર્ગાસે નાભિયેરના પાંદડામાં સ્ટ્રો બનાવી છે. આ સ્ટ્રો ઓર્ગનિક, પર્યાવરણને અનુકૂળ, કુગ વિરોધી છે અને નાભિયેરનું પાણી, ઠંડા પીણા વગેરે પીવા માટે પ્લાસ્ટિકની સ્ટ્રોના બદલે ઉપયોગ થઈ શકે તેવી છે. જૈવ વિઘટન થઈ શકે તેવી આ સ્ટ્રોથી વર્ગાસ વૈજ્ઞિક સ્તરે પ્રશંસાને પાત્ર બન્યા છે. દુનિયાના વિવિધ ભાગોમાંથી તેમને ઓર્કર મળી રહ્યાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા પર ભાર મૂકી રહ્યાં છે ત્યારે પ્રોફેસર વર્ગાસની આ શોધ તેમની આ ચળવળને મજબૂત કરવાની સાથે સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં ખાસ કરીને મહિલાઓ માટે રોજગારી સર્જનના નવા છાર ખોલે છે. ■



Narendra Modi @narendramodi ·

@SecPompeo અને @EsperDoD સાથે મુલાકાત આનંદાયક રહી. ભારત-U S વચ્ચેના સંબંધીમાં જબરદસ્ત પ્રગતિ અને ગ્રીજા 2+2 સંવાદના પરિણામો જોઈને ઘણી ખુશી થઈ. આપણી વ્યાપક વૈશિષ્ટ વ્યૂહાત્મક ભાગીદારી સહિયારા સિદ્ધાંતો અને સહિયારા વ્યૂહાત્મક હિતોના મજબૂત પાયા પર ઉભી છે.



Nitin Gadkari @nitin\_gadkari

આદરણીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi તુના નેતૃત્વમાં મંત્રીમંડળે જાહેર ક્ષેત્રની કંપની OMC ક્ષારા ઇથોનેલની ખરીદી માટેના વ્યવસ્થાતંત્રને મંજૂરી આપી છે અને ખાંડ તેમજ ગોળના રસ આધ્યાત્મિક ઇથેનોલના ભાવમાં પણ વધારો કર્યો છે.



Sadananda Gowda @DVSada...

ભારતના ફાર્મા ક્ષેત્રમે છેલ્લા કેટલાક મહિનામાં પહેલાંથી જ આગામી માર્ગનું બટાવ્યો છે. વૈશિષ્ટ ફાર્મા પૂરવઠા સાંકળમાં ભારત એક મુખ્ય ખેલાડી તરીકે ઉભી આવ્યું છે. ખૂબ ટૂંકા સમયમાં આપણે બીજા ક્રમના સોથી મોટા PPE કિટ ઉત્પાદક બની ગયા હીએ: PM @narendramodi



Smriti Z Irani @smritiirani ·

શાણની સામગ્રીમાં ફરજિયાત પેકેજિંગના માપદંડો લંબાવા માટે મંજૂરી આપવા બદલ PM @narendramodi જ અને મંત્રીમંડળનો આભાર. વિવિધ પ્રકારની શાણની થૈલીઓમાં 100% ખાદ્યત અને 20% ખાંડનું પેકેજિંગ અનિવાર્ય કરવાના નિર્ણયથી ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં 3.7 લાખ કામદારો અને 40 લાખ ખેડૂતોને લાભ થશે.

## Work hard, Modi tells IAS probationers

**Putting emphasis on team work,** Mr. Modi told the probationers that when they work together, there will be more success and impact of their work on the district or department.

He said the focus of the "steel frame" of the country should not be merely in managing the daily affairs but in working for the progress of the nation. Reminding the newly recruited batch of civil servants about Sardar Patel's philosophy on his 145th birth anniversary, he said "serving the citizens of the country is the highest duty of a civil servant".

The Prime Minister asked the probationary officers to *not get absorbed with the*

## PM to launch Ghogha-Hazira Ropax Ferry Service on Nov 8

EXPRESS NEWS SERVICE  
AHMEDABAD, NOVEMBER 1

PRIME MINISTER Narendra Modi will virtually inaugurate a Ropax Ferry Service between Ghogha in Bhavnagar of Saurashtra region and Hazira in Surat on November 8, said Union Minister of State for Shipping (independent charge), Chemulpati K. Fertilizers and Manohar Mandavia on Sunday.

Addressing a press conference here, Mandavia said the Ropax Ferry Service between Ghogha and Dahej in Bharuch district will be discontinued and a passenger-only service will be functional on the route once a

erage in the media."

He said the government had put focus on providing training to impart new skill sets to public servants.

"Training plays a very important role but earlier, not much attention was paid to it. But now, we are paying a lot of attention to the human resource and the training aspect. The government has started Mission Karmayogi, a new experiment in capacity building."

He was referring to new initiatives such as Mission Karmayogi or National Programme for Civil Services Capacity Building, which is aimed at setting up of capacity building commission on Sunday.

Addressing a press conference here, Mandavia said the Ropax Ferry Service between Ghogha and Dahej in Bharuch

district will be discontinued and a passenger-only service will be functional on the route once a

## PM takes stock of Covid vaccine distribution plans

EXPRESS NEWS SERVICE  
NEW DELHI, OCTOBER 15

PRIME MINISTER Narendra Modi Thursday chaired a meeting on Tuesday to review the Covid-19 vaccine research and deployment ecosystem, taking stock of the Health Ministry's plans for distribution and delivery. He also called for scaling up of serosurveys and testing.

During the meeting, procurement issues, technologies for bulk stockpiling, and vials for distribution were discussed, a government statement said.

The Prime Minister stated that regulatory reform was a dynamic process, and experts in every current and emerging domain should be used by the regulator proactively, as many new



PM Narendra Modi

and support for all such efforts," the government statement said.

The Prime Minister was attended by Union Health Minister Harsh Vardhan; Dr V K Paul, member (health), NITI Aayog and chairman of the National Expert Group on Vaccine Administration; Principal Scientific Advisor Prof K

## PM: MSP vital for food security system, govt committed to it

### FIGHTING NUTRITIONAL DEFICIENCY THROUGH BIOFORTIFIED CROPS



### Paddy procurement at MSP in Punjab this season up 103%

Procurement of paddy at minimum support price (MSP) by government agencies in Punjab doubled during this Kharif marketing season, registering a 103% increase till Thursday, compared to the corresponding period last year amid the ongoing protests of farmers against the recently enacted farm laws, reports *Dipti Dash*.

Official data show that till Thursday, the overall procurement of paddy across states had increased by 28% compared to last

## Govt lifts curbs, but not for tourist visas

NEERAJ CHAUHAN  
...@indiatimes.com

34H: The Union government decided on Thursday to graded relaxation in travel restrictions for nationals and Indian leaders wishing to enter or leave country, except on these grounds:

THE VISAS WOULD NEED TO BE APPLIED FOR PHYSICALLY AS THE E-VISA FACILITY REMAINS SUSPENDED

SESSIONS/ATTENDMENT G UNDER

INTEND MEDICAL ATTEND-

MENTAL ATTEND-

MENTAL ATTENDMENT



“ આપણું બંધારણ દેશના પ્રત્યેક નાગરિકના અધિકારો અને ગૌરવનું રક્ષણ કરે છે જે આપણા બંધારણના ઘડવૈયાઓની દીર્ઘદિના કારણે સુનિશ્ચિત થઈ શક્યું છે. હું પ્રાર્થના કરું છું કે, 'બંધારણ દિવસ' એ બંધારણીય આદર્શો અને મૂલ્યોને જાળવવા પ્રત્યેની આપણી જવાબદારીને મજબૂત કરે છે અને આમ, રાજ્ય નિર્માણમાં યોગદાન આપે છે. આખરે તો, આપણા બંધારણના ઘડવૈયાઓનું આ જ સપનું હતું. ”

— પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી